

23.  
2390-

ગોધા જૈનસંઘસિરિય અંથાંક ૨

જેન સ મા જ ના ૩૮૫૫

અ. ગ.

# માર્ગદર્શક વિચારણા

: બેખુ :

ન્યાયચંદ લક્ષ્મીચંદ સોાની ( સાદરાવાળા )

બી. એ. એલએલ. બી.

નિવૃત એજન્સી વડીલ.

બેન સ મા જ ના. ટિંકે પો

અંગે

# માર્ગદર્શક વિચારપુષ્પ

: કેન્દ્ર :

આધ્યાત્મ લક્ષ્મીચંદ સોની ( આહસ્વાળા )

બી. એ. એટ. એડ. પી.

નિવૃત એજન્સી પટીલ.

# કુંઈ કુ

---

આ નિષંખ વિષે અમારે ખાસ કહેવાનું નથી. વિદ્ધાન લેખકેજ આ વિષે પોતાના નિવેદનમાં જણ્ણાવેલ છે, તેમણે સમાજ પ્રત્યેની સુધારણા માટે ધગશથી કડવું લાગે તેવું લખેલું વાચકને કહાય જણ્ણાય પરંતુ તેની પાછળ તેમના હૃદયની લાવના કેવળ સમાજ આગળ ધપે એજ છે. હીલની ધગશથી ગ્રેરાઇને લખેલું છે માટે તેમની મનોભાગતા લાવના વિચારી આ નિષંખ વાંચવામાં આવે તો સમાજ વિચાર કરતો જરૂર બને તેમ અમોને લાગે છે.

ગોધા નૈનસંધસિરિજ તરફથી આ નિષંખ પ્રકાશિત કરવા સહાય મળેલી છે તેથી આ પ્રકટ કરવાનું શક્ય બનેલ છે આવી રીતે સામાજિક પ્રગતીમાં સૌ કોઈ સહાયભૂત યાય તેમ હિચ્છીએ છીએ.

વિદ્ધાન લેખકે આ નિષંખ પ્રકટ કરવાનું કાર્ય અમારી સંસ્થાને સોખ્યું તે લાગણી બદલ તેમનો આલાર ભાનીએ છીએ.

ભાઈયાંહ અભરયાંહ રાહ

B. A LL. B.

માનદમંત્રી:—શ્રીયજોવિજયનૈનશ્રયમાણિ

પ્રકારાક.

ાંધી ચોક ભાવનગર (સૌરાષ્ટ્ર)

[ ધર્મ સંવત ૨૮ વીર સંવત ૨૪૭૬ ]

# લેખકનું નિવેદન

શ્રી મુખ્ય જૈન યુવકસંધના પાક્ષિક મુખ્યત્વ “પ્રભુજી જૈન” તરફથી સને ૧૯૪૭ ની સાચમા “જૈન ધર્મ અને સમાજનો ઉત્કૃષ્ટ આધુનિક સમયને અનુલક્ષીને શી રીતે થાય” એ વિષય ઉપર છનામી નિયંત્ર લખી મોકલબાની જહેરાત કરવામાં આવેલ તે ઉપરથી આ નિયંત્ર તૈયાર કરવામાં આવેલ તેને પ્રસિદ્ધ કરવાની અમૂહ્ય તક મળતાં હશ્ય અને ગૌરવ અનુભવું છું અને આ નિયંત્ર લખવા માટે પ્રેરણા કરનાર સંરથાનો તેમજ તેને પ્રસિદ્ધ કરવાની અનુકૂળતા કરી આપનાર અંધુર્યોનો સહખ્ય આભાર માનવા રજી લઈં છું.

દુનિયાભરના પ્રત્યેક દેશના આગેવાન દેશનાયકો રાજકીય, સામાજિક, ધાર્મિક, ઔદ્ઘોગીક વગેરે વિધવિધ ક્ષેત્રોમાં પોત પોતાના દેશને તેમજ સમાજને સર્વોદ્યની લાવનાથી આગળ વધારવા માટે અનુકૂળ સાધન સામની તેમજ સાધન સંપત્તિમાં વૃદ્ધિ થાય તે રીતે સર્વત્ર શાંતિ અને નિર્ભયતાનું વાતાવરણ ઉલ્લું કરવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે-આ ઉત્કાંતિના વચ્ચાનાણાના ( Transitiond period ) સમય દરમીયાન ભારત વર્ષના આપણા દેશનેતાઓ દેશની અને સમાજની-સમરસત પ્રનાગણની સાર્વત્રીક ઉજ્ઞતિ માટે જે અપૂર્વ સાધના કરી રહ્યા છે તેમાં, સંખ્યા બળમાં વધ્યો નાનો ગણ્યતો છતાં પણ અન્ય બાધતોમાં કંઈક અંશે મહત્વ ધરાવતો આપણો જૈન સમાજ યત્ત કિંચિત ફણો આપવા શક્તિધાળા બને તે ગણ્યતરીએ આ નિયંત્ર યોગ્ય વિચારણા માટે સમાજ સંમુખ રજુ. કરવામાં આવે છે અને આશા રાખવામાં આવે છે કે જૈન સમાજના અગ્રગદ્ય વિચારક અને કાર્યશાલ અંધુર્યો, યોગ્ય જરૂર મુરતી ચર્ચા-વિચારણા કરી, પ્રત્યેક જૈન બંધુનો જ્ઞાય અને સહકાર મેળવી વિધવિધ કાર્યસાધક અને સંગીન યોજનાએં તૈયાર કરી તેને તાત્કાલીક અમલમાં મુક્ખ્ય માટે સંગ્રહીન પ્રયાસ

કરવા કદીબદ્ધ થશે તો લેખણ પોતાનો પ્રયાસ કંઈક અંશે સાર્થક અને સહેલ થયો માનશે.

વીજળ્ણું વેગે આગળ વધતા આ જગૃતિના જમાનામાં આપણે અસાધારણ વાતનાઓ સહન કરી તેમજ પારાવાર બડીહાનના બોગે અહાં છેન્ટે અને અનુસ પ્રમાસે ને વાગ્યાદી ગ્રામ કરેલ છે તેને ટકાવી રાખવા માટે તેને સાર્વત્રીક આભાદીના સાચા સ્વરૂપમાં ફેરફારી નાખવાં માટે આપણી પોતાની સરકારને તેમની માગણી મુજબ સંપૂર્ણ કૃપા અને સહકાર આપવા માટેની આપણી જવાબદારી તેના સાચા સ્વરૂપમાં આપણે સમજી લેખ્યો અને તે દિશામાં આગળ વધવા માટે આપણું તેમજ હેઠ લરમાની તમામ પ્રજા-હરકેટ ડેમ કે સંપ્રતાય-પોતાનો ઇરજ અને જવાબદારી સમજતી થાય અને તેને અદ્દ કરવાની તમના સેવતા થાય એ રીતે દૈશખરમાની સમસ્ત પ્રજાના અગ્રીભુત અન્યેક વિનિવિધ સમજો અને તે તે સમજની અગ્રીભુત મન્યેક વ્યક્તિઓ-પોતાનો ઉત્કર્ષ અને ઉત્તુતિ સાધવાના છે અને તે માટે વગર વિલંબે જગૃત અને દ્વિભાગ થવાની આવસ્યકતા છે આવી આવસ્યકતાનું અપૂર્વ મહિને સમજવા માટે જ આ નિબધમાની વિચારણા આગળ કરવામાં આવે છે.

સમજની જેને કંઈ પડી નથી, સમજ પ્રત્યેની જવાબદારીનું જેને લાન નથી, સય સઅભી સમાલેની નીતિ રીતિમાં જ ને રાચી માચી રહ્યા છે, થાંચ ઇકનતખોણે સાંઅહેણો કે કાળ્ય બજરોણા પ્રવૃત્તિમાં જેણો મોજ મજાહ માની રહ્યા છે અને તાગ દિના કરી રહ્યા છે તેમને મણ આ નિબધ કંઈક અંશે મણ પોતાની સમજ પ્રત્યેની સાચી જવાબદારીનું લાન કરાવે ચોપો આશા પદ્ધન અસ્થાને નથી.

શુલ્ષ ભૂયાતું સર્વે જન્હુનાં—એ જ અભ્યર્થતા.

ભાવનાર-નિર્મણ ચંદ્રકુંજ માણેકલાદી ૪૨૦ ના. ૩-૧૨-૪૬ સ. ૨૦૦૬ ના મામચર શુદ્ધી ૧૩	વડીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ બી; એ; એદ; એલ; બી. નિવૃષ એજ-ન્યી વડીલ.
---	---

## શ્રી નવર્ખંડા પાંશ્વનાયાં નમઃ

જૈન દિલિએ પ્રત્યેક જીવાત્મા મૂળ સ્વરૂપે નિર્મણ સ્ક્રીક  
મણિ જર્વેની વિશુદ્ધ અને અનંત શક્તિનો ધણી માનવામાં  
આવે છે પરંતુ ધગધંગતા જ્વલંત અંગ-  
ચરમતીર્થી કરે રાને રાખના હગલાથી ઢાંકી હેવામાં આવ્યો  
શ્રી મહાવીર હોય અગર તો નિર્મણ સ્ક્રીક મણિરલને  
કિન્ન ગ્રહણીત ફેંકી હેવામાં આવ્યું હોય અને તેના ઉપર  
જૈન ધર્મ અને ધુળ-મારી અને કચરાનો પુંજ બામવા  
જૈન સર્વાજનું હેવામાં આવ્યો હોય તેમ આ જીવાત્માને  
**દિગ્દર્શિન** અનાદિ કાળથી શુલાશુલ અનેક પ્રકારના  
કર્મદળોના આવરણોથી આવરી હેવામાં  
આવેલ છે. આ રીતે વધેલા ઓછા અંશે, પ્રત્યેક જીવાત્મા  
મુળસ્વરૂપે વિશુદ્ધ અને અનંત શક્તિનો ધણી એક જો  
પ્રકારનો હોવા છતો કર્મદળથી સંકલીત હોવાથી અનેક  
જીવાત્માઓ માનવાના રહે છે. કર્મની વિચિત્રતાને લીધે  
તેઓ અનેક પ્રકારની જુદીજુદી દશાઓ લોભવતા જણાય  
છે. કર્મના આવરણોથી જીવાત્મા તદ્દન સુકૃતદશા પ્રાપ્તો  
કરવાને શક્તિમાન થતો નથી ત્યાં સુધી તેને આ સંસ્કારમાં-  
લવસાગરમાં જન્મ-મરણુંના ફેરા કરવાના અને અનેક  
પ્રકારની સુખ-દુષ્ટ, શાતા-અશાતા પોતાના કર્મવચ્ચેત  
લોભવવાના રહે છે.

રાગ—દેષ, વિષય, કૃષાય, કોધ, માન, માયા, લોભ,  
મોહ વળેરેના પરિશીલનથી જીવાત્મા ક્ષણે—ક્ષણે કર્મદળોના  
આવરણોમાં—કર્મબંધનમાં વધારો—ધરાડો કર્યો જ જય છે  
અને તેથી જ જીવ—ભ્રમણુનો અંત લાવવામાં મોટી આડ-  
અલિકૃપ થનારા કર્મબંધનોના કારણુરૂપ મોહ, રાગ,  
દેષ, વિષય, કૃષાય વળેરેને અંતરંગ શત્રુઓ માનવામાં  
આવ્યા છે. ધનિદ્રયદમન, સંયમ, દાન, શીલ, તપ—જપ  
ક્ષ્યાન, યમ, નિયમ, મત, પદ્યાખાણુ વળેરે અનેક પ્રકારના  
સાધનોનો ઉપયોગ કરી, અતુલ સામર્થ્ય અને અપૂર્વ  
વીર્ય સ્કુરણુથી ઉપર જખુાવેલ અંતરંગ શત્રુઓ ઉપર વિજય  
મેળવી જીવાત્મા જ્યારે સધળા કર્મના બંધનોને તોડી નાંએ  
છે—સકળ કર્મનો ક્ષય કરે છે ત્યારે તે મોક્ષરૂપ પરમ  
શાશ્વત સુખ મેળવવા લાભશાળી થાય છે અને સાહિ—અનંત  
અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરે છે. જ્ઞાન કિયાભ્યાસુ મોક્ષઃ—આ  
અને આવા ધીળ અનેક સૂત્રો અનુસાર જીવાત્માની ઉપર  
મુજબની પરિસ્થિતિનો, લગભગ તમામ જૈનેતર દાખિએ  
પણ એક યા ધીળ ઇપે વિવિધ પ્રકારના વણુંનો ત્થા  
ચર્ચાઓ આગળ કરી છેવટે સ્વીકાર જ કરે છે અને ગ્રત્યેક  
વિવેકી—વિચારશીલ જીવાત્માઓનું અંતિમ ધ્યેય, મોક્ષ  
સુખરૂપ ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવાનું જ હાય છે.

ઉપર જખુાવ્યા મુજબના મુક્તાત્માઓ પૈકી જૈન શાસ્ત્ર-  
કારોની માન્યતા મુજબ કેટલાક આત્માઓ પોતાની  
અંતિમ લવસ્થિતિ દરમીયાન તીર્થંકર નામ કર્મના ઉદ્ઘથી  
ચતુર્વિધ સંધરૂપ તીર્થની સ્થાપના કરે છે અને તેથી

તીર્થંકર કહેવાય છે. આવા તીર્થંકર લગવાનોએ ઉપર જણાયા મુજબના અંતરંગ શત્રુમોને લુતી લીધાથી તેઓ અહીંતુ લગવાન યાને જિનહેવ પણ કહેવાય છે અને લંઘ પ્રાણીઓને આ સંસારદ્વપ સાગર તરી જવાના, પાર ઉત્તરવાના મુખ્ય સાધન તરીકે ઉપયોગમાં લેઈ શકાય તેવા ધર્મની પ્રદ્રષ્પણું શ્રી જિનેશ્વર હેવોના શ્રીમુખે કરવામાં આવેલી તેથી તે જૈનધર્મ અને તેના અનુયાભીઓનો કે અનુસરનારાઓનો સમાજ તે જૈનસમાજ યાને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાર્ડપ ચતુર્વિધ જૈનસંધ.

જૈન દર્શનની કાળ ગણુત્તીની માન્યતા મુજબ આ જગત અનાદિકાળથી ચાહ્યું આવે છે અને અનંતકાળ સુધી ચાહ્યું રહેવાનું છે એટલે આજસુધીમાં જુદાજુદા સમયે અને જુદાજુદા ક્ષેત્રમાં ઉપર જણાયા મુજબના અનંત તીર્થંકર લગવાનો થઈ ગયા છે અને હવે પછી પણ થવાના છે તે ધોરણે આ ભરતક્ષેત્રમાં પણ કાળબન્ધના પ્રથ્યેક ઉત્સર્પણી અને અવસર્પણી કાળના છ આરા દરમીયાન ચોવીશ તીર્થંકર થઈ ગયા છે. આવી અનંત ચોવીશીઓ થઈ અહીં અને તે અનંત ચોવીશીઓ પૈકી છેલ્લી-વર્ત્તમાન ચોવીશીના છેલ્લા ચરમ તીર્થંકર શ્રી મહાવીર લગવાને અત્યારે વીર સંવત ૨૪૭૩ મો ચાલતો હાવાથી. આજથી સુમારે ૨૫૦૦ વર્ષ પહેલાં કેવળજાનની પ્રાર્થિ ખાદ મહાસેન વનમાં પધારીને હેવોએ રચેલ સમવસરણુમાં જનધર્મની પ્રદ્રષ્પણું કરી, ચતુર્વિધ સંઘર્ષપ તીર્થની સ્થાપના કરી અને “સવીળુષ કરેંશાસન રસી”

એવી ઉચ્ચતમ લાવનાથી એક ગામથી છીને ગામ પોતાને વિહાર ચાલુ રાજ્યો, કયો તે વખતનો જૈનસંધ્ય અને હાલનો જૈનસમાજ? તેના સંખ્યાખળમા તેમજ સર્વીગી વિકાસકર્માં ઉત્તરાત્તર અનેકાનેક કારણોંવશાતુ કેટકેટલા વૃદ્ધિ-હાનિ અધ્યાપિ પર્યાંત કેવી રીતે થતી રહી તેની ઔતિહાસિક દાયિત્વ યથાર્થ અને વિક્રતાપૂર્વું સમીક્ષા તો કેાં નિષ્ણાત પુરાતત્ત્વવિહિ-સિદ્ધહસ્ત લેખંક જ કરી શકે.

“સ્નાતસ્યા” ની સ્તુતિની ત્રીજી ગાથામાં જણ્ણાંબયાં મુજબ શ્રી અહોતું ભગવાન શ્રી મહાવીર સ્વામીના શ્રી મુખ્યથી-પ્રશભરિસનિમન્દ્ર દૃષ્ટિ ચુંમવાળી પ્રસત્ત વહનકર્મણથી ઉદ્ઘાત પામેલ વચનામૃત-ઠેતી વાગ્ધારાને તેમના ગણ્યધર મહારાજાએ જીલી લેદ તેની યથાર્થ-અર્થ-ગંભીર-રહુસ્યપૂર્વું શાખ્દોમાં રચના કરી અને નવ સૈકાઓ બાદ તે પુસ્તકાઙ્કફ થતાં સુધી જૈન સંધના બુદ્ધિમાન અને વિકાન જૈન મુખ્યાં જવો તેમે વિશાળ દ્વાદશાંગીર્દિપે પોતાના શક્તિશાળી સ્મૃતિપટમાં ધારણું કરી રાખી અને પુસ્તકો-૩૬ થયા બાદ કાળ બણાના પ્રતાપે અને આપણી કંઈક બેદ્રકારીના પરિણામે તેને ધર્મનુકર્ષાનિ પહોંચ્યા છતાં પણ સફલાપ્યે આપણી પાસે હળવોની સંખ્યાથી ગણ્યી શકાય તેટલા ધ્રમશાસ્ત્રનો પુસ્તકો મોણું છે અને તેથી જન સમોજને ર્યાલિમાન અને ગૌરવ લેવા જેણું છે.

ઉપરોક્ત વિવેચનથી સ્પષ્ટ થાયું છે કે જૈનધર્મ અને જૈનસમાજ અનોદિકાળથી અસ્તિત્વનું ધરાવે છે અને અન્ય

તિર્થિકરાની માઝે ચરમતીર્થિંકર શ્રીમહાવીર ભગવાને  
સ્થાપેલું તીર્થ-પ્રરૂપેલો જૈનધર્મ અને તેને અનુસરનાર  
જૈનસંધ યા જૈનસમાજ અનેક પ્રકારના જંગાવાતો અને  
પ્રત્યાધાતીગળોની વર્ણે પણ અદ્યાપિ પર્યંત ઉચ્ચ  
મસ્તકે ટકી રહ્યો છે. સામાન્ય રીતે જે ધર્મ અને તેના  
અનુયાયીઓ રાજ્યનો આશ્રય શુમાવી એઠેલા હોય છે  
તેમને મધ્ય યુગમાં તેમજ ખ્રીયીશ રાજ્યની સ્થાપના  
પહેલાં અનેક પ્રસંગોએ ઘણું ઘણું સહન કરવાના મોકા  
આવી પડ્યા છે. આવા પ્રસંગો જૈનધર્મને અને તેના  
અનુયાયીઓને અનેક વખત ઉલા થયાની ધતિહાસ ગવાહી  
આપે છે છતાં પણ. તેમાંથી તેઓ વધતું-એષું નુકશાન  
વેઠીને પણ બચી ગયેલ છે. આરપાર પાર ઉત્તરેલ છે આ  
પ્રકારના જૈનધર્મ અને સમાજનો ઉત્કર્ષ આધુનિક સમયને  
અનુલક્ષીને કેમ થાય તે આપણું આગેવાનોએ ખાસ  
વિચારવાનું છે. કેવળ વિચારણાથી તે કાર્ય સિદ્ધ થઈ  
શકે નહિ પરંતુ સંગીન વિચારણાના પરિણામે સર્વાંગી  
વિકાસ અને ઉત્કર્ષ માટે ધરખમ ચોજનાએ તૈયાર કર્યા  
તેને અત્યર અમલમાં સુકવા માટે ગમે તેટલા લોગે પણ  
કટીએન્દ્ર થવાની જરૂર છે.

૨૫૦૦ વરસ પહેલાં વર્તમાન સમયમાં પ્રચલિત જૈન-  
ધર્મ અને સમાજ ( ચતુર્વિધ સંધ ) ની સ્થાપના થઈ-  
ત્યારે દેશ-કાળ કેવો હતો, આજુબાન્નું સંક્ષુદ્ધ વાતા-  
વરણ કેટલે દરજો અનુઝળ કે પ્રતિઝળ હતું તેનો અને  
ત્યાર પછી વખતના ઠેણુના ૨૫૦૦ વરુસના ગાળા દુર-

મીયાન તેમાં કેવા ફેરફારે। થતા રહ્યા અને અવનવા કેટલાં પ્રત્યાધાતી બણો સમય પદટાતો ગયો તેમ કેવા રીતે ઉલાં થયા અને જૈનસમાજે તેનો કેવી રીતે સામનો કર્યો અગર તો સમાધાનવૃત્તિથી નમલું આપી પોતાનું અસ્તિત્વ અને રહ્યું સછું ગૌરવ ટકાવી રાખ્યું તે બધી બાબતોનો જે તે વિષયના નિષ્ણુત આગેવાનોએ હીર્દી દૃષ્ટિથી વિશાળ ઐતિહાસીક સમાલોચનાપૂર્વક વિચાર કરવાનો રહે છે અને તે વિચારણાના પરિણામે જે કંઈ સુદ્ધાની હીકિકત અને સિદ્ધાંતો રળ્યું કરવામાં આવે તેમજ અનુભવસિદ્ધ ઘટનાએ આગળ કરવામાં આવે તેનો આપણે લવિષ્યને માટે સહઉપયોગ કરવો જોઈએ. સમાજના ઉત્કર્ષની કલ્યાણ માર્ગ સુધીઠીત સાધનોનો ઉપયોગ કરી હીત વૃદ્ધિની ચિંતા-કરનારા, ઉદાત્ત લાવના અને વિશાળ દૃષ્ટિથી વિચાર કરનારા-સેવાભાવી કાર્યકુશળ સમાજનેતાએ. સમક્ષ, જન તેમજ જૈનેતર સમાજોનો અઢીથી ત્રણ હાર વરસો સુધીનો ઈતિહાસ-ઐતિહાસીક પુસ્તકોનો લાંડાર, અનેક મહાન् જ્યોતિર્ધરો તેજસ્વી પુરુષો ધર્મવીરો અને કર્મવીરોના જીવન ચરિત્રોથી અંકીત, અનેક પ્રકારના વિધ વિધ વિષયોની બાબતોમાં અનેક જાતની મડાગાંડો અને ધુંચોનો ઉકેલ કરતા ગંભીર રહુસ્યોથી ભરેકો, અનુભવપૂર્વ ઓધપાડો શીખવતો ખડે પગે તૈયાર છે તેનો બરાબર ઉપયોગ કરવામાં આવે તો તે આપણું હુથ ધરેલ પ્રક્રિયાના ઉકેલ માટે મદ્દગાર થઈ પડે તેમ છે.

લગભગ ત્રણ હાર વરસો સુધીનો હુનિયાનો શૂંખલાખડ  
ઈતિહાસ ઉપલબ્ધ થઈ શકે તેમ છે અને તે એક અનુભવી

લોમીયાનિ માર્કે અનેક રીતે માર્ગદર્શિક થઈ પડે તેમ છે. તેમાંથી આપણે હાથ ધરવાની ચોજનાઓની રૂપ-રેખા તૈયાર કરવા માટે અમુલ્ય સલાહ સુચનો મેળવી શકાય તેમ છે તેમજ તે લાલખતી ધરી આપણુંને; અક્ષમ્ય બુલો. કરતાં કે આડે માર્ગ હોસાઈ જતાં કે ખડકો સાથે અથડાઈ જતાં અચાવી શકે તેમ છે અને તેથી આપણે કાર્યદક્ષ, સેવાલાવી કાર્યકરો અને ઉદ્ઘાર ધનિકો ઉપરાંત નિષ્ણુત દીતિહાસ-જોનો પણ સાથ મેળવવો જોઈશે.

ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ તીર્થની સ્થાપના કરી ત્યારે જૈનધર્મ અને ચતુર્વિધ સંધની સ્થાપનાની

ઉદ્ઘોષણા કરી ત્યારે, હેશભરમાં પ્રાક્તણેનું જૈનધર્મ અને જેર હું ઉપરાંત વધી ગયું હતું, શાન-જૈન સમાજની ચુગ આથભી ગયો હતો. અને વિધિ-વિધાન તીર્થની-સ્થા- તેમજ કિયા કાંડનો ચુગ પ્રવર્તતો હતો, પના સમયનું નિર્જરાનાં હેતુરૂપ વિવેક અને શાનપૂર્વકની ધનધોર વાતા તપશ્ચયાનું સ્થાન હૃઠયોગની તપશ્ચયાએ વરણું.

લીધું હતું અને શત્રુના વિનાશ માટે કે

હુન્યવી વસ્તુની પ્રાપ્તિ માટે તેને વેડળી નાંખવામાં આવતી હતી, યજ-યાગાદિનો ચુગ પુરજેશમાં પ્રવર્તી રહ્યો હતો. અને તે પ્રસંગે હારેદ્રા અવાચક નિરાધાર પણુંયોની અને કવચિત્ નરમેધ પ્રસંગે મનુષ્યોની પણ છડે ચોક હિંસા થતી હતી અને તેને વેદ વિહિતા ગણી અહિંસાની કોટીમાં મુકવામાં આવતી હતી, અહિંસા પરમો ધર્મનો ઉત્તમોત્તમ સિદ્ધાંત તદ્દન બુલાઈ ગયો હતો, વણી-

૮

અમધર્મની ધવણ પુરખારમાં ફૂરકતી હતી, પરં પરાના પુનારીઓમાં જાળા—આંખરાના થયોથી દટ્ટાઈ ગયેલ રૂઢીઓનું અળ એટલું ખુલ્લું જામી ગયું હતું કે તે વખૃતના ત્રૈવીશમાં તીર્થિકર શ્રી પાર્વતિનાથ સ્વામીના અનુયાયી જેન સમુદ્ધાય ઉપર પણ તેની અસર ફેંચી હતી, પુરુષ વર્ગને અનહદ પ્રધાનત્વ અપાઈ રહ્યું હતું અને નારીગણને તદ્દન પશુની કોટીમાં સુકી દેવામાં આપ્યો હતો ચન્દ્ર-યાગાદિ પ્રસંગે થતી હિંસાના પરિણામે માંસાહાર અને મધ્યપાન ધણા બધી ગયા હતા અને વેદ વિહિત ધર્મના સાચા નીચે તેનો છડે ચોક ઉપરોગ થતો હતો, આ બધી હાનિકારક અને પાપમૂલક ધ્રટનાઓ સામે, તેનાથી નીપજતા અનથી અને પ્રત્યાધાતી ખણો સામે લગવાન મહાવીરે સખ્તમાં સખ્ત જેહાદ પોકારી હતી અને તેમાં તેમને ધણે અંશે વિજય પ્રાપ્ત થયો હતો. વળી સહભાગ્યે તેમના જ સમકાલીન ખુદ્ધ ધર્મના સ્થાપક ગૌતમખુદ્ધ પણ તેમના સંઘની સ્થાપના કરીને ઉપરોક્ત તમામ પ્રત્યાધાતી ખણો વિરુદ્ધ અંડ ઉઠાવવામાં ઓછી જહેમત ઉઠાવી નહોતી.

આ ખાળતની લાંખાણું ચર્ચા અહીં કંઈક અસ્થાને હોઢી એટલું જ કહેવું ખસ થઈ પડશે કે લગવાન મહાવીરે સ્થાપેલ ચતુર્વિધ સંધ-જન સમાજ હાલની માઝે કેવળ મોટા લાગની વણીક જ્ઞાતિમાં સંકોચાઈ ગયેલો નહોતો પરંતુ પ્રાક્તાણ, ક્ષત્રીય, વૈશ્ય અને ક્ષુદ્ર ઉપરાંત હાલમાં અસ્પર્શ્ય ગણ્યુતા હરિજન વર્ગને પણ તેમાં સ્થાન હતું અને પ્રતધારીઓની સંખ્યા લાઘ્યાથી ગણ્યુતી હતી ત્યારે

અવિરતીઓની સંખ્યા કરેડોની હતી વળી આરંભ કાળમાં તો ચશ્મા-મહારાજાઓનો પણ સારી સંખ્યામાં તેને સાથ હતો મગધનરેખર શ્રેષ્ઠીક, ચંડપ્રદોત ઉદ્ઘાટન, શતાનિક, નંદીવર્ધન, ચેહામહારાજ વગેરે અનેક રાજા-મહારાજાઓ મહાવીર લગ્નાનના અનુન્ય લક્ષ્ણ હતા. તેમના ચતુર્વિધ-સંધને-જનસંમાજને એટલું છાંડું ઉચ્ચય સ્થાન અપાતું હતું કે તેને “નમો તીર્થસસ” કહીને લગ્નાન દેશનાની શરૂઆત કરતા કારણું કે આ સંધમાં અનેક લાવી તીર્થ કરે અને મુક્તાત્માઓના જીવેનો સમાવેશ થતો હોવાનું માનવામાં આવતું હતું.

સાધ્વી અને શ્રાવિકા ઇપે નારીગણુને પણ શ્રીમહા-વીરના સંધમાંથી ખાકત રાખવામાં આવેલ નહીં. લગ્નાનું આણુંંદ, કામહેવાદિ હસ મુખ્ય પ્રતધારી જૈનસંધની શ્રાવકો તરીકે અને ચંદ્નણાલા, મૃગાવતી, પ્રાચીન જાહેર રેવતી, સુલસા ધારીણી વગેરેની મુખ્ય જલાલી અને શ્રાવિકાઓ તરીકે ગણુના થતી હતી. સ્થાતે પછીના સ-પના કાળ પછીથી ધણ્ણા વરસો સુધી જૈન ભયના પ્રત્યા-સમાજનો દીન-પ્રતિદીન ઉત્કર્ષ થતો રહ્યો ધાતી બળો પરંતુ પાછળથી પ્રત્યાધાતી બળોનું જોર વચ્ચે પણુંતેનું વધતાં જૈન સમાજ અનેકાનેક કારણે રક્ષી રહેલું અ-વશાતું સંખ્યા બળમાં તેમજ સર્વાંગી વિકાસ સાધવામાં પાછો પડતો ગયો, અને આને અદીહજાર વરસોના ગાળા પુછી જનસંખ્યા માત્ર પંદરલાખે જ્ઞાવી જોંચી છે આમ ક્ષતાં

પણ ભૂતકાળમાં શ્રી ઉમાસ્વાતિ, સીંહસેનહીવાકર, હરિ-  
લદ્રસૂરિ, અલયહેવસૂરિ, હેમચંદ્રાચાર્ય, હીરવિજયજી, યશો-  
વિજયજી જેવા અનેક ધુરંધર આચાર્યોનો સાથ અને સહકાર  
તેમજ સંપ્રતિ, ખારવેલ, અશોક, કુમારપાળ, વનરાજ,  
સીંહરાજ જેવા રાજની-મહારાજાઓનો રાજ્યાશ્રય ત૥ા બાગ-  
ભાઈ, બાહુડ, ઉદ્ય વિમળશા, વસ્તુપાળ-તેજપાળ વગેરે  
મંત્રીશ્વરો અને સેનાનાયકો તેમજ શ્રેષ્ઠિવર્યો જવડશા,  
સમરાશા, લામાશા, કર્માશા, દ્યાળશા, મોતીશા જેવા લક્ષ્મી-  
નંદનોની ઉદ્ધાર હાથે પુષ્કળ મદ્દ મેળવવા જૈનસમાજ  
આગ્યશાળી ન થયો હોતતો ભારતવર્ષમાં આપણું આસ્તિત્વ  
ઓછોની માઝુક કદાચ બુંસાઈ ગયું હોત-હુમ પ્રાય થક  
ગયું હોત.

પ્રાચીન સમયના-ભૂતકાળના જૈનધર્મ અને જૈન સમા-  
જના યશસ્વીજવન-જવલંત કારકીર્દી તેમજ તેજસ્વી અને  
ગૌરવવંતા પ્રભાવને યાદકરી આધુનિક જૈન સમાજને નીહા-  
ળતાં આપણે આંસુ સારવાનાજ રહે છે પરંતુ તેથી કંઈ  
આપણો શુક્રવાર વળે તેમ નથો. આપણે તો હવે આધુનિક  
સમયને અનુલક્ષીને-આજ્ઞા ખાજુના સર્વ સંચોગાનો, અનુ-  
કૃળ તેમજ પ્રતિકુળ વાતાવરણુનો બરાણર અભ્યાસ કરીને,  
જૈનધર્મનો સવિશેષ પ્રચાર અને ઉદ્ઘોત કરવા માટે તેમજ  
જૈન સમાજનો સર્વાંગી વિકાસ સાધવા માટે અતુલ પ્રયાસ  
અને ઉદ્યમ કરવાની જરૂર છે. અન્ય ધર્મી-ભાઈણંધ કેમોની  
હુરેળમાં ટકી રહેવા માટે તેમજ અનતા પ્રયાસે તેનાથી  
આગળ વધવા માટેનું પરમધ્યેય કાયમને માટે આપણું

નજર સન્મુખ રહેવું જોઈએ અને તેની સીઢી માટે હરેક પ્રકારના સાધનોનો અવિરત પણું ઉપયોગ કરવામાં લેશમાત્ર પાછીપાની કરવી જોઈએ નહિં. ધ્યેયની સીઢી માટે કેવા કેવા કેટકેટલા સાધને મહદ્દગાર થઈ પડે તેમ છે તેનો ખરાખર અભ્યાસ કરી તે એકહાથ અને એકત્રીત કરવાની સંગીન ચોજનાઓ. નિષ્ણાત કાર્યકરોની મહદ્દથી તૈયાર કરવી અને તેને ત્વરીત અમલમાં મુકવા માટે ધનિક આગેવાનોને દાન પ્રવાહની આખી દીશા બદલવાની અનિવાર્ય જરૂરીયાત સમનવી તેમનો પુરેપુરો સાથ અને સહકાર મેળવવા માટે એકપણ તક જતી કરવી જોઈએ નહિં.

પ્રથમ નજરે આ ખાખત જેટલી સામાન્ય જણાય છે તેટલી સામાન્ય નથી અને તેથી આખા સમુદ્દરે હવે તો જાગૃત થવાની જરૂર છે. અગ્રગણ્ય આગેવાનોની દોરવણી નીચે સામુદ્દર્યિક જાગૃતિનો જીવાળ ચોમેર પ્રસરે અને ધાર્મિક તેમજ સામાજિક ઉત્કર્ષ માટેની ચોજનાઓનું સુનિશ્ચીત રૂપ-રેખા સાથેનું ધડતર-બિધાન પૂર્ણથતાં તેને સચ્યાટ અને સંગીન રીતે અમલમાં મુકવા માટેનો હાહીક પ્રયાસ સમાજની પ્રત્યેક વ્યક્તિનો ઈંટ વિષય થઈ પડે અને તેને માટે એકજ ધૂન-એકજ તાન અને તલ્લીનતા ઉલરાઈ જતાં જણાય તો આપણું અને સાધ્ય વસ્તુ વર્ચેનું અંતર કુપાઈ જતાં વિલંખ થાય નહિં.

ઉપરોક્ત સામુદ્દર્યિક જાગૃતિ માટે યતકિંચિત પ્રયાસનો આરંભ કરતાં જેલા સમાજની અને ધર્મની આધુનિક પરિસ્થિતિનો આપણે ખરાખર વિચારણા પૂર્વક અભ્યાસ

કરી લેવો જોઈએ. આવા અલ્યાસથીજ સમાજમાં પ્રવતો  
રહેલ નિર્ણયકતા, અંધાધુંધી, કદાચહ પૂર્વકના પક્ષલેહોના  
સુવિશેષ પ્રચાર માટેના તનતોડ પ્રયાસો, અનેક પ્રકારના  
સામાજિક જરૂરિયા પ્રશ્નોના ઉકેલ માટેની અક્ષર્ય ઉપેક્ષાવૃત્તિ  
અને એદરકારી, ક્ષણે ક્ષણે પલટાતા સમયના પરિવર્તનોને  
અને કાળ-ખળની શક્તિને યથાર્થ સ્વરૂપે આગામીની  
શક્તિમાં ઉણ્ણુપ, પ્રત્યેક વ્યક્તિની સમાજ પ્રત્યેની વધતી  
આછી જવાણદારી અને આવશ્યક ઇરાઝોની ખાણતમાં કેવળ  
ઉદાસીનતા ઉપેક્ષાવૃત્તિ, પરાકાષ્ઠાએ ઘેણાંચેલ લાંચ-રૂશવતની  
અને કાળાખણારીયા પ્રવૃત્તિમાં દિન-રાત રેાકાઈ રહેતા  
સ્વાર્થ નિષબ્ધુ જનોની સંખ્યામાં થતી જતી વૃદ્ધિ, સાચા  
માર્ગ તેમજ પરમ લાભદારી રીતે થઈ શકતા યથાર્થ  
સ્વરૂપના સ્વામીવત્સલ્યનું હાઈ સમજવાની અશક્તિ-  
અનિચ્છા યાતો સંકુચિત મનોદશા, કહેવાતા આગેવાનોની  
ખાલી વાહવાહ અને કિર્તિના ગાનેથી સતોષાતી હીન  
મનોવૃત્તિના કારણે નિષ્કિયતા યાતો અર્થહીન પ્રવૃત્તિ,  
ભરતામાં ભરતી થયે જાય તે રીતે હજુ પણ વહેતો રહેતો  
દાન પ્રવાહ વગેરે અનેક પ્રકારની તુટીઓનો અને ઉણુપોનો  
સાચો ખ્યાલ આવી શકે તેમ છે અને તે તમામ તુટીઓ  
હરકોઈ ઉપાયે આપણે દૂર કરવાનીજ રહે છે તે સિવાય  
એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી.

બ્યવહાર કુશળ-વિચકણુ નીરીક્ષક સહેલાધીથી જોઈ  
શકે તેમ છે કે આપણો આધુનીક નૈન સમાજ, સંખ્યા  
ખળની તેમજ શુણુવત્તાની ( quantity and quality )

દિન-પ્રતિદીન ઉત્તરતો જાય છે. તેનું શું કારણ ? તેની આપણે નિષ્ઠાંત ચિકિત્સકની દર્શિથી મીમાંસા કરવાની જરૂર છે એટલું જ નહિ પણ વધારે કુશળતા પૂર્વે કે તે તે કારણું હું કરવા માટેના ઉંઘાયે. યોજવાની જરૂર છે.

જૈનસમાજ તેના સ્થાપના કાળથી અને પછીના ડેટલાક સેકાંગ્રા. સુધી પુરણહારથી કુલ્યા અને ઝાલ્યા પર તું પાછળથી

જ તે સમયેના અગિવોનેની કઢુક સાંકુઅધુનીક જૈન ચિત્ત મનોહરશાશ્વી અગર તો વધતા જતા સામાજની વિરોધી-પ્રત્યાવાતી ખણાના પ્રલાય તેમ છીજી લીજી ઘણી હામિ જોયતી રહી. વચ્ચે વચ્ચે સ્થિતિ અને યુગપ્રધાન સહશ ભદ્રાનુભાવ પુરુષાના તેના કારણો, પ્રતાપે કઢુક ટીક ટીક ઉદ્યોગ જાળુંતો રહ્યો પરંતુ આખરે તેની સ્થિતિ શોય-

-નીય અને વિચાર કરતા કરી મુકે તેવી થઈ પડ્યાનું જણાય છે. અત્યારે આખણું જૈનસમાજ મુખ્ય ત્રણ લગિમાં શ્વેતાભદ્ર-દેરાખાસી સ્થાનકવાસી અમે દીગાભદ્ર એ રીતે વહેચાયેલા જણાય છે એટલું જ નહિ પણ હેડ મુખ્ય વિલાગમાં પણ મત-મતાંતર ગંછ લેહ પણાપણી અમે મનસી પ્રડ્યાના કારણું અનેક પણોની સ્થાપના થઈ ગઈ છે અને વખતના વહેણું સાથે એક-ધીબાની વચ્ચે આંતર ઘટવાને ખફલે વધતું જ જાય છે. તેમજ કવચિત એક ધીબા પણે વચ્ચે સામસામા મોચાય છે અને અનેક રીતે આમાણુક ઉત્કર્ષના પુષ્ય કાર્યમાં ઉપયોગી અને મહદ્યાસ થઈ પડે તેવી હું ઉપરાંતના દ્વારા અને શક્તિનો મોટા પ્રમાણુમાં નિરર્થક હું પણ્યોં થઈ રહેતું છે.

એક ખાળુ અંદર—અંદરના લેદ. પ્રલેહો, મત—મતાન્તરો અને પક્ષા પક્ષોને કારણે આંતર કલ્પેણ. વધતા ગયા અને બીજુ ખાળુ પ્રારંભ કાળમાં જ્યારે જૈનસમાજમાં પ્રત્યેક વર્ણના હતારો અને લાઘો મનુષ્યો જૈનધર્મના ફ્રેક્ટા વાવરા નીચે પરમશાંતિ અને આનંદ પૂર્વક જીવન નિર્વાહ સાથે ઔહિક અને પારલૌકિક સુખની સાધના કરી રહ્યા હતા અને જીવનના વિકાસ ક્રમમાં આગળ વધી રહ્યા હતા ત્યારે આધુનિક જૈનસમાજ લેહ—પ્રલેહોમાં ઠેંચાઈ જવા ઉપરાંત મોટા લાગે કેવળ વર્ણિક કોમની અસુક પેટા જ્ઞાતિઓમાંજ સંકુચીત થઈ ગયેલ છે, આ ખાખતના સાઝ—સાઝ મુળભૂત સવિસ્તર હકીકતો જાણેના પ્રમાણુભૂત કારણે તો ૨૫૦૦ વરસોનો જૈન કોમનો શૃંખલાખ્ય ઈતિહાસ કેાઈ નિષણુત અસ્થાસક તૈયાર કરે તો તેમાંથી જ મળી શકે તેના અભાવે છુટક છુટક પ્રસીદ્ધ થયેલ ઐતિહાસીક અન્થો અને પ્રાચીન મહાપુરુષોના જીવન ચારિત્રોના પાના ઉથ્થાવવાથી પણ આપણી ચડતી પડતીના કંઈક કારણો મળી આવે ખરા અને કંઈ નવો પ્રકાશ પણ મેળવી શકાય, આ ખધી ખાખતો એક સ્વતંત્ર નિષંધનો જ વિષય થઈ પડે તેમ છે છતાં પણુ પ્રસ્તુત વિષયને અંગે એટલું તો ભાર દર્દીને કહી શકાય કે આપણુ સંખ્યા બળમાં હદ ઉપરાંત ઘટાડો થઈ જવાનું કારણુ—ખાસ કરીને રાજ્યાશ્રયનો અભાવ અને ચુગ પ્રધાન પુરુષોની જોટ વળી મધ્યયુગ અને તે પછીના સમયમાં શૈવધર્મ વૈષ્ણવધર્મ અને ખીજ અનેક ધર્મોનું જોર વધી જતાં, જીવન નિર્વાહ, લગ્ન સંખ્યાંધ તેમ જ ખીજ

અનેક સામાજિક વ્યવહારીક ખાખતોમાં તાત્કાલીક વિશેષ લાભ મેળવવાની દૃષ્ટિએ એક સાથે હુણારોની સંખ્યામાં શાતિજનો ધર્માંતર કરવા લલચાયા અને તેનો કંઈક તોડ કાઢવાને બદલે આપણું પૂર્વપુરુષો આ બધું શાંતચિત્તે-ઉદ્દાસીન વૃત્તિથી જોઈ રહ્યા હોએ કોઈ કોઈ પ્રસંગે ઉપર ખતાવેલ કે અન્ય કોઈ કારણોને લઈ આપણું જૈન સમાજમાં પણ સારી સંખ્યામાં જૈનેતર બંધુઓ દાખલ થયા પરંતુ તેવા સંગેં તો કંઈક વિરલજ જણ્ણાય છે. એ રીતે જૈનધર્મ અને જૈનસમાજ માટેના ઉઘોત કાળના પ્રસંગે વિરલ ખની જતાં સમાજ સંખ્યા ખળમાં ધણું ધટી ગયો અને સાથે સાથે ગુણું વત્તામાં પણ કાળ ખળના પ્રલાવે, આંતર કલહેણા પ્રતાપે તેમજ નવચુગના થતા જતા મંડાણું અને પ્રલાવ તરફ પુરતું લક્ષ્ય નહીં આપી શક્યાથી, નવા જમાનામાં ખાસ આવશ્યક જણુતા સફળણેણે સારા પ્રમાણુમાં ખીલવી શક્યા નહીં એટલે સમાજ કંઈક નીચેજ ઉત્તરતો ગયો અને હુંએ આગળ વધવા માટે વર્તમાન જૈનસમાજને

નસીબે તનતોડ પ્રયાસ પૂર્વક સામુદ્દાયીક

**સમયની** ખળ કેલવવાનું રહે છે. આજનો, સમય અત્યેક વ્યક્તિને સમાજ પ્રત્યેની તેની

આવશ્યક ઝરણે અને યથાર્થ જવાણદારીનું

સચ્ચાટ લાન કરાવી રહેલ છે. સમયને સારી રીતે એળખી લેવાની જેએં દરકાર કરતા નથી-પરિવર્તન શીલજમાનાનું જેએં યથાર્થ રીતે મુલ્યાંકન કરી શકતા નથી અને કેવળ સ્વાર્થ પરાયણું વૃત્તિથી-તદ્દન સંકુચીત દૃષ્ટિથી, પરમાર્થ-

હીન મનોદથાની ડેટીમાં ઉત્તરી જઈ સમાજ પ્રત્યેનું  
પોતાનું રણ અદ્વા કરવામાં ગાડેલ રહે છે તેમને સમાજ  
કેઈ પણ રીતે નિભાવી કેદી શકે તેમ નથી છુટી છવાઈ  
પાચ-પચીશ વ્યક્તિઓના ગર્ભે તેટલા પરિશ્રમો કે ઉદ્ઘોથી  
સમાજ-ઉત્કર્ષનું કાર્ય સીદ્ધ થએ શકે તેમ નથી જૈન સમાજ  
શાસ્ત્રના નિર્ણયાત્મકાંગ્રેના જૈન તેમજ જૈનતર્ચ સમાજની  
ચક્કઠી-પડતીના "ઇતિહાસજ્ઞા, સેવાલાવી," કાર્યદૃષ્ટ અને  
વ્યવહાર કુશળ આગેવાનોના ઉદારચિત્ત ધનિક બંધુઓના  
સતત સાથ અને સહકાર ઉપરાત પ્રત્યેક વ્યક્તિના પીડ  
ખળની જરૂર છે. સમાજની પ્રત્યેક વ્યક્તિએ તન, મન અને  
ધનથી સમાજ ઉત્થાનના કાર્યમાં પોતાનો ફોળો આપવા ઉત્સુક  
રહેલું જોઈએ. જુત કાળમાં આપણે જેને નાની મારી લુલો કરી  
હોય, તુટીઓ બતાવવી હોય, તેમજ અનેક પ્રકારની ઉણપણ  
અને ખામીઓનું પ્રહર્ણન કથું હોય તેમજ વર્તમાનમાં પણ  
તેવીજ પરિસ્થિતિ ચાલુ રહેવા હેવામાં આવી હોય તો તે  
બધું આપણા કડવા-મીઠા અનુભવેનો સહઉપયોગ કરી  
વગર વિલાંઝ આપણે સુધારી કેવાની, તેમાં યથોચિત પલટો  
લાવવાની અનિવાર્ય જવાબદારી આપણે માણે આવી પડે  
છે. જુનું એટલું સોનું જ માની કેવાની અક્ષમ્ય લુંઠ કરવી  
જોઈએ નહિ. ક્ષણે ક્ષણે પલટાતા ગગન વિહાર અને વાસુ  
દ્વારાના, તાર, ટેલીઝોન, રેડીયો, વર્તમાનપત્રો તેમજ તેવી  
ખીંચ અનેક પ્રકારની અનુકૂળતાએ. અને સર્ગવડો પુરી  
પાડતા આ જમાનામાં ફુનિયાના તર્મામ દેશો અને પ્રહે  
શોનો પ્રનાલો સાથીના અનેક વિધ સર્પક અને વ્યવહારી

નેડાણુથી આપણુને પ્રત્યેક ખાબતોમા અનેક પ્રકારના બોધપાડો અને અનુભવસીજ શીક્ષા વચ્ચેનો આપણી નજર સંમુખ ઠવલાઈ રહ્યા છે. આધુનિક સંચોગો અને સામ્ઝલિક પરિસ્થિતિનો સુદ્ધમ પણ વિશ્યાળ દર્શિથી આપણે વિચાર કરી તેનો બને તેટલો લાલ લેવો નેછા.

જૈનધર્મનો ઉત્કર્ષ ધ્મામપૂર્ણ દેખાવોથી કે આડંબરસુક્ત ધામધુમ અને ઠાડમાડ સાથેના દેખાવો કે મોટા મોટા વરચોડાએ અને ખાલી દેખાવો ધામધુમથી કરવાની દર્શિથી કે જતાનુગતિકતાના સાચો ઉત્કર્ષ સિદ્ધાંતને પ્રાધાન્યતા આપી, કેવળ વાહુવાહુ નથી. કહેવરાવવા ખાતર યાતો માથે આવી પડેલા કારલાર ઉકેલવાની બુદ્ધિથી ઉપરેશક વર્ગના વિચારોને હુદ ઉપરાંતનું મહાવ આપી, વિશુદ્ધ ભાવના અને ઉચ્ચ કિયાશીલતા ગૌણુદ્ધામાં સુકાઈ જય તે દીકે કંઈક ઐંચાઈ જઈને દેખાદેખી કે ખાલી વાહુવાહુ કહેવરસવાના બ્યામોહમાં ફસાઈને, સસ્તી કીર્તિ કે નામના ખાટી જવાની ભાવનાથી વિચારશીલપણ્ણાની ઉષ્ણપનું ગ્રહશીન કરી સુધ્યક મનોદ્ધામાં મર્જન રહો કરવામાં આવતા ઉત્સવો—મહોત્સવોથી જ સારી રીતે થઈ શકે છે એવી માનતાઓ અને ખ્યાલો હવે આપણે ખંખેરી નાંખવા નેછાએ. છેલ્લા ૫૦-૬૦ વરસોમાં મુંબાઈ, અમદાવાદ, સુરત, પાટણ, ભાવનગર જેવા રહોટા શહેરોમાં આપણે વરચોડા, દેખાવો અને ધામધુમ પાછળ લાઓ રહ્યેયાનો ૦૪૪ કર્ચે. હશે તેથી સમાજ કે વ્યક્તિગત પુણ્યખળ કેટલું વધ્યું તે તો ગાની મહારાજ

જીએ ખરંતુ તેથી સમજનો કે ધર્મનો કોઈપણ અંશો  
 જિંહાઈ સંખાચાનું દાખિશત થતું નથી. આવા વરઘોડાઓ; જોઈ  
 ચોકું પણ જૈનેતરખંડુ જૈન થયાનો દાખલો મળી આવતો નથી  
 ખરંતુ કોઈ કોઈ વ્યવહાર કુશળ નિયક્ષણ વ્યક્તિઓ તરફથી  
 દીકાઓ. થતી સાંભળીએ છીએ કે વાણ્ણીયો. વરઘોડ ગાંડાતુર  
 ખંની બ્યા છે. અને હાજારો રૂપેયા નિરર્થક વેડપ્રી નાએ છે  
 અનેકથોટો સાચી વણિકવૃત્તિને તિલાંજલી આપી હાજારો રૂપેયાના  
 અર્યાન્ના ખદલામાં તદ્દન નજીવા લાલથી મન મનાવી લઈ  
 કુલખુલું બની જાય છે. આવા દેખાવોથી કે વરઘોડાઓથી  
 શાસ્ત્રનોનો કે ધર્મનો ઉદ્ઘોત કેટલો. થાય છે. તે જાણુવાની  
 કંઈ પારાશીશી મળી આવતી નથી; જો કે તેના જાણુગા તો  
 ધણ્ણા ધણ્ણા કુંકવામાં આવે છે. મહોટા મહોટા શહેરોમાં  
 જિત્સાંગો પ્રસંગોના વરઘોડાઓ ઉપરાંત સાધુ-મહારાજના  
 સ્તુત્યા પ્રસંગોના વરઘોડા ચડાવવામાં આવે છે અને તેસાં  
 અનુઝી સંખામાં હાથીએ—એનુભવાલોએ. અને સાંખેલાઓ  
 જીવાતેના અતિશાયોક્ષિત—બર્થા લાંખા લાંખા વર્ણનો પેપરોમાં  
 જીપાવી માનવૃત્તિને હુદપારખણુદ્વાવવાસાં આવે છે. આવા વર-  
 ઘેણાએ. પાછળ કે કંઈ લખણું ટ ખર્ચ ઠરવામાં આવે છે  
 સેમાંદી ધણ્ણા થાડો લાલ દેવદ્રવ્યનેકાણે જાય છે પરંતુ મહોટા  
 બાઘતું અર્ય તો કેવળ (unproductively). કંઈપણ જામો  
 જાલ કે યાઢલો. આપ્યા સિવાય નિર્ધર્થક રીતે વેડકાઈ જામ  
 એનુભાવી કેસી કોઈ શહેરોમાં સો લગ્ન પ્રસંગે આપા  
 નાજીવાજના વરઘોડા ચડાવુણાની મૃથા જાથી મડી છે અને  
 અન્યાન્ય વર્ગની કોઈમાં પોતણી વણુના કરાવવા માણે જાયા

સાધિયો. એકાર પડવાથી વર્ષાલરમાં આવા વરદોડાની સંખ્યા ઘણું વધ્યી પડે છે. દુઃખગાળામાં રોજ બરોજ દેખાવો અને આવા વરદોડા ની કંઈયે જલ્યા છે અને કોઈ વરદોડાચો. વખતતો એકજ હીવસુમાં સત્તાર-સાંજ એમ પાછળ લાણો બે વખત લેકેને વરદોડા જોવા મળે છે. રૂપૈયાનો અપ્ય આવા વરદોડાથી ધર્મિક કે વ્યવહારિક અથય સમાજને, કે વ્યક્તિત્વને કેટલો લાલ થતો હશે-જૈન-બૈનેતર સમાજ ઉપર તેની ફેવી અસર થતી હશે-ખર્ચના પ્રમાણુમાં કેટલો નજીવો લાલ થતો હશે-તે બધી બાણસોનો ચથાર્થ ખ્યાલ તો કોઈ નીડર અને સિદ્ધહસ્ત લેખક જ આપી શકે. આવા ધામધુમીયા હેઠાવો પાછળ થતા લાણોના ખર્ચનો ખ્યાલ કરવા એસીએ તો તરતા સ્પષ્ટરીતે જણ્ણાઈ આવે કે તેવા ખર્ચનો મ્હેદો લાગે દરબારી રીયાસતો અને તેમાંનામાંથી લાવંવામાં આવેલ હાંથીએ. અને તેના સરંબનમના નકરા પાછળની, જેરણો. અને સીધાઈએ. વગેરે ભાડુતી માણુસોના ઈનામ અકરામ પાછળની, સાંઝેલાએ. અને વિકટોરીયા મારેના ઘોડાના સભાળનારાએને બંદ્ધીસે આપવામાં હ્યા પાંચ-સાત નુદાળુદા એન્ડવાળાએના હીસાણ ચુકવવામાં વેડફ્રાઇ કાય છે. આડંખર-પ્રિય રૂઢીચુસ્ત શ્રદ્ધાળું લાઈએ, તરતમતાએ લાલાદાલની વિશાળ દૃષ્ટિ ઉંડી ગણુની નંદી કરતાં આવા ધામધુમીયા અને ભલાકલાર્યા ડેખ્યોએથી શ્રોટ્લા માણુસ આકર્ષાઈ ભાગી છે કે અધિંતો શ્રીએ આરા પ્રવર્ત્તિ નાંદો છે. એવી સત્તામૃતી માન્યતા આપાણ હંડો હંજુ પણ

ઓળમી સહીમાં વસતા મનુષોનો આપણુને આલાસ્ક કરાવે છે. સમાજ આવા આલાસોથી કયારે સુકૃત થશે તે વિચારવા જેવું છે.

સમયને, યુગળને, પલટાતા જમાનાને ઓળમી લેવાનું સામર્થ્ય, તેનું સુલ્ય, તેમજ તેની મહત્વપૂર્ણ ઉપયોગીતા હજુ પણ આપણે ધરાગર સમજ શક્યા નથી એટલે તેવા સામર્થ્યને કેળવીને-તેને પુષ્ટ બનાવવાની વાતતો આપણુંથી ફરની હુરજ રહે છે. વિધિ-વિધાન અને ડિયાડાંડની અનેક વ્યવહારિક અને ધાર્મિક ધ્યાનોમાં જુગણુના પુરાણું મંદ્રકારો ઉપર પરંપરાગત રાહ-રશમ અને ઇદ્ધાળના પ્રતાપે એટલા બધા જાળા-ઝાંખરા અને થરો બાજી ગયા છે કે તેનું શુદ્ધ રહુસ્ય કે મૌલીક હાઈજ તદન જુલાઈ ગયું છે અને તેને પરીખુંમે આપણે હુદ ઉપરાંતના જન-શક્તિ અને દ્રવ્યનો નિરર્થક વ્યધ કરી રહ્યા છીએ. શાસનહેવ આપણુને તેમાંથી કયારે બચાવશો?

છેલ્લા વિશ્વયુક્તને કારણે ખાદ્ય પદાર્થો ઘણા ઉંચા ભાવે પણ મેળવવાનો સુશકેલીએ વધી સરકારી ગયા છતાં, વ્યવહારીક તેમજ ધાર્મિક અંકુરો આશી-પ્રસંગે થતાં જમણવારો, માનભુખ્યા વર્દિ રૂપ માલેતુંનરો ‘પીછેસે ચલી આતી હું’ ના ધોરણે મ્હોટા ખર્ચો પણ કર્યો જતા હતા તે રાજ્યસત્તાનો અંકુર સુકાતાં છતાં પણ કવચીતું છાનાં-છપના થતાં રહેતા હતા. આવા અંકુરોથી કંઈક સુકા બેશું લીલું પણ ધળી ગયેલ એટલે તદન નિરસ (ખદ રસ રહીત) અને હુખું નવ ઢીબસો સુધી એકજ વખતનું સામુદ્ધાર્યિક

જમણુ-આસો તથા ચૈત્ર માસમાં આવતી આયં ભીતની ઓળખી પ્રસંગેનું જમણુ, અંકુશના કાયદાના મુણભૂત હેતુ ને મહદુગાર થઈ પડે તેવું છતાં અટકાવવામાં આવેલ તોપણુ સરવાળે-એકંદર રીતે આવા અંકુશો આર્થિર્વાદ્રિપુથી પડ્યા હતા. એનેતાં આપણે ઉપર જણાવી ગયા તેવા વરધોડા-હેખાવો વગેરે ઉપર પણ રાજ્યસત્તાએ ખાસ અંકુશ મુક્યો હોત તો તે ખાસ કરીને જૈનસમાજને એક મોટા આર્થિર્વાદ રૂપ થઈ પડત કારણું પ્રમાણુમાં જૈનેતર સમાજે કરતાં જૈનસમાજ આવા વરધોડાઓ પાછળ દ્રોધનો શક્તિનો અને સમયનો હૃદ્યાંય કરવામાં ઘણું ચડી જાય છે. હવે આપણે જાતે જ તે સુંબંધમાં શાંતચિત્તે વીવેકપૂર્વક, લાલા લાલની દૃષ્ટિએ વિચાર કરી સામુદ્દર્યોક ઉત્થાન માટે-સમાજના સર્વાંગી વિકાસ અને અભ્યુદય માટે, ઉંડી ધગશ અને ખરી તમજા ધરાવતા હોઠાએ, તે માટે સાચી તાલા-ચેલી જગી હોય તો આવા અનેક રૂપ રીવાજે અને રાફરશેનોમાં સમયને ઓળખી ધરમુણથી ઝેરક્કારે કરવાના રહ્યા અને શક્તિ તથા દ્રોધને સાચા કલ્યાણુકર-લાલદ્યાં માર્ગે વાળવાનો રહ્યો.

**સમાજ-ઉત્થાનના પરમહીતકારક મહાભારત કાંઈ પ્રદેશમાં આપણુને સાચા સેવાલાવી, અંગત**

**સુકાન કેને સ્થાપિતહિતો ( vested rights ) ની લેશ સુપ્રત કરવું** માત્ર પરવા નહી કરતાં તદ્દન નિઃસ્વાર્થ વૃત્તિથી અને પરમાર્થ બુદ્ધિથી તન મન અને ધનની પોતાની સર્વ શક્તિઓનો લોગ આપનારા, રચનાત્મક કાર્યક્રમમાં સાચા દીવથી અને વિશુદ્ધ લાવથી

રસ લેનારા, સમાજ હૃતના કાર્યમાં જેનો જેનો સાથ અને સહકાર મળે તેમને—જરૂર જણાતાં યથોચિત પુરસ્કાર આપી ને પણ અપનાવી લેનારા, સમાજ—ઉત્કર્ષના ધ્યેયની સીદ્ધિ માટેના સાધનો અજખુત પનાવનારી ચોજનાઓ બાબે તેમજ સંગહુતપૂર્વક તેને અમલમાં મુકવા સંબંધમાં રાત—દીન અવિરત ઉત્સાહ અને અંતપૂર્વક વિચાર કરતા રહી ઉદ્ઘાસ્તીલ રહેનારા, નવયુગના સાચા સ્વરૂપને પીછાની લેઈ સમાજને આગેકદમ પૂર્વકની ફરેક પ્રકારની પૂર્વ તૈયારી માટેના એક પણ તક જતી નહી કરનારા, કૃતનિશ્ચયી, ચારિત્રશીલ, પ્રમાણીક, ઉદારદીલના મહાનુભાવ પુરુષોના હાથમાં સમાજનું સુકાન સેંચ્યા સિવાય આપણી સીદ્ધિ નથી થઈ એઠેલા, કહેવાતા આગેવાનેના દહાડાહવે લરાઈ ગયા છે. કિરીલોલી, માનલુખ્યા, સ્વાર્થી, મનસ્વી રીતે સમાજનું ગાડું ગયાડાંયે જનારા પોતાને ફાવે તેમ હાંકયે રાખનારા, તેનેદેખી ધર્ષાયોર, કદાચહી, સમાજના સેવક થઈને રહેવાની વૃત્તિ ધારણું કરવાને બદલે શીરછત બની એઠેલા આગેવાનો ને હવે સમાજ આ કાંતિ યુગના જમાનામાં નિલાવી લઈ શકે નહી દેશ ભરમાંથી વિદાય લેતી શ્રીટીશ ચોમેર કુરી— હકુમતના પ્રદેશમાં કે રાજસ્થાની પ્રદેશમાં વળેલ કાંતેનું ચોમેર-સર્વત્ર કાંતિનું મોઞું કુરી વળ્યું મોઞું—સર્વત્ર છે. રાજકારણ કે અર્થકારણમાં ધાર્મિક કે કુંકાતો કાંતિ- વ્યવહારીક ખાંખતમાં, શોઠાઈ કરતા શ્રીમંતુનો પવન વર્ગમાં કે નોકરી કરતા નોકરીયાત વર્ગમાં, ઔદ્યોગીક સંસ્થાઓમાં કે મન્જૂર મંડળોમાં,

સંધ—સમાજ કે જ્ઞાતિઓના નાના મોટા વર્તુલોમાં, ધનિક કે ગરીણ વર્ગમાં, અધિકારીઓએ માં કે તાથાના નીચા દરજાના કારકુલોમાં, સર્વત્ર કાંતિનો પવન કુંડાઈ રહ્યો છે. સૌક્રોષ્ણ પોતાના હડક-અધિકાર અને સમાન દરજાનાની જળવણી માટે તવસી રહ્યા છે. અને સાથે સાથે સમાજ પ્રત્યેની પોતાની ઝરને કે જવાખદારી અદ્દા કરવાની તૈયારી ખતાવી રહ્યા છે. સાર્વભૌમ ખ્રીટોશ સરકાર છેવટની વિદ્ધાય લેવાની તચારીમાં અડપલેર આગળ વધી રહી છે. દેશ ભરની પ્રજા સકાળુની શુલામીમાંથી છુટી થઈ આઓફી અને સ્વતંત્રતાના ઉંખરે આવીને ઉલ્લી છે. શાહીવાદ અને સાંઘ્રાન્યવાદના અંધારા ઉલેચાઈ જતાં પ્રજાવાદ, લોકમતવાદ અને સમાજવાદનો જવલંત પ્રકાશ ઝણહળી રહ્યો છે. લોકશાહીના નગારા સર્વત્ર ગડગડી રહ્યા છે. પોતાને દ્વારાંશી માનનારા સેણમી સહીમાં વસતા રાજ-મહારાજાઓ પણ હવે સમજવા લાગ્યા છે કે પ્રજાના હૃદયને જીતી લેવાની ખરી ચાવી, આપખુદ સત્તાના ઉપયોગમાં કે સર્વસત્તાધીશ માલીક તરીકેના મોર્ચા માંડવામાં નથી પરંતુ દ્રસ્ટી અને પ્રજાના સેવક તરીકે છોવાની જાહેરાત કરવામાં જ છે. જ્ઞાતિ કે સમાજના આગેવાનોએ પણ લખેને ગૃહુસ્થ દશામાં હો કે સાધુ દશામાં હો તેમનું સ્થાન ટકાવી રાખવા માટે ણડકમહારી કે અહુંલાવ અંગેરીનાંખી, સમાજના તમામ વર્ગના મનુષ્યોનો સાથ અને સહકાર મેળવી-લેઈ તે બરાબર જળવી રાખી, પોતાની જવાખદારીના સંપૂર્ણ લાન સાથે, પરંપરાગત રુદ્ધ સંસ્કારો અને ચાલી

આવતી પ્રણાલીકાને શ્રીકટાઈથી વળજી ન રહેતાં, સમયને ઓળખીને જ આગામી ધપવાનું છે. સામુદ્દારીક જગૃતિ-પૂર્વકનું તેમનું આવું પ્રયાણું જ આગે વધોની ઘોષણા-પૂર્વકની સમૂહગત કુચ જ આપણું ઉજ્ઞતિ અને પ્રગતિ આટેના ધ્યેયની નજીક લઈ જશે.

જૈન સમાજમાં અને તેમાંપણ ખાસ કરીને ક્વેતામણરે ના દેરાવાસી તેમજ સ્થાનકવાસી વિલાગોમાં સાધુઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે વળી છેલ્લા સાધુ વર્ગનું પચાસેક વરસોમાં આપણા દેરાવાસી સમુદ્દર્યનું દ્વારા એકના સ્થાને ૭૦-૮૦ કેટલા આચાર્ય લગવાનો—સૂરિપુંગવો અમુલ્ય વાલ આપી રહ્યા છે. ચતુર્વિધ સંઘમાં તેમનું સ્થાન કંઈક અનેાખું જ છે. કુદ્ડકે અને લુંઝકે આગળ વધતા આ જીાન-ચુગના આધુનિક પ્રગતિસાધક જમાનામાં પણ આપણા સમાજમાં સાધુવર્ગનું સમાજના આગેવાનો તરીકેનું તેમનું અથસ્થાન જળવાઈ રહ્યું છે. શ્રદ્ધાળુ ધનિકવર્ગ તેમના એક શુષ્ટ માત્રથી કંઈપણ લાંબો વિચાર કર્યા સિવાય હુઅરે ઝૂપયા ખર્ચ કરવા તથાર થઈ જાય છે. તેમની લલામણુના પુસ્તક પ્રસિદ્ધ માટે કે તેમનો અલ્યાસ આગળ વધારવા માટેની દરેક પ્રકારની અનુકૂળતાઓ કરી આપવા માટે, એકાદ એ જ આધુઓ માટે પણ મોટા મોટા પગારના જૈનેતર શાસ્ત્રીઓને ખાસ રોકી લેતાં. સમાજ લેશ માત્ર ખંચકાતો નથી. સહભાગ્યે શ્રી સંઘના રીજર્વ ઇંડો પણ આવા પ્રસંગે ખુલ્લા થઈ જાય છે. ચોમાસું રહેવા માટેની

વિનંતિનો જીવીકાર થતાં રહેલા સંધને આવા શાસ્ત્રીઓના પગાર વળેરેના મોટા ખર્ચો કણુલી દેવા પડે છે એટલે અને કે કમને આંગણે ધોળો હાથી ખાંધ્યા નેવી સ્થિતિ થઈ પડે છે. આમાનુશાસ્ત્ર વિહાર દરમીયાન ઉપહેશધારા હેતી મુકવાની તેમને અનુકૂળ તકો સાંપડતી હોવાથી તેમજ સામાન્યરીતે ગમે તેવા શક્તિશાળી ગૃહસ્થ કરતાં મુનિ મહારાજના ઉપહેશની અસર સમાજના મહોટા ભાગ ઉપર તો કંદુક ચમતકારો અને અદભૂત જ થઈ પડે છે. તેમનો પડયો છોક જીવી દેવાને અનેક લક્તાજ્ઞનો ખડેપગે તૈયાર જ હોય છે. ધીમે ધીમે એક ખીંચનો સહવાસ વધતાં આ સંખંધ એવા પાટે ચરી જય છે કે પ્રખર વક્તા કે વાચાળ ઉપહેશકના દિષ્ટરાળી લક્તાજ્ઞનોનું મંદળ મોટા મોટા શહેરોમાં સ્થપાઈ જય છે અને તેમાં પછીથી ભીજ કોઈનો ગજ વાગતો નથી. સમાજમાં એવો વર્ગ હણુપણું અસ્તિત્વ ધરાવતો જણ્યાય છે જે એવી મનોદશા ધરાવતો હોય છે કે સૂરી-મહારાજ માથે હાથ મુકે એટલે તેના નસીણ આડે રહેલ પાદકું ખર્ચી જય અને પોતે લખપતિ થઈ પડે.

નૈનેતર સમાજના સાધુ વર્ગ કરતાં અનેક હૃષિકે આપણો સાધુ વર્ગ ઉચ્ચી કક્ષામાં રહ્યો શક્યો છે અને તેથીજ સમાજ ઉપરનો અશ્રેષ્ટ તરીકેનો તેમનો કાબુ અને પકડ હણું બારાબર જળવાઈ રહ્યા છે. તેમના તરફની શ્રાવક જ્ઞાનહાયની માનવૃત્તિ અને લક્તિમાં પણ કંઈ ઉણુપ જણ્યાની નથી. વળી સહભાગ્યે પ્રખર શક્તિશાળી, વિદ્વાન અનુભાવી અને કાર્યદક્ષ સાધુ વર્ગને જૈનધર્મ અને જૈન

સમાજના સાચા અભ્યુદય-ઉત્કર્ષ કે પ્રગતિ સાધવા માટેનો આવાર નવાર અનેક તડો મળતી રહે છે તેમજ તે તડોનો સહઉપયોગ કરી લેવા માટે પણ તેમને પુષ્કળ સમય ફ્રાજલં હોય છે. સમાજ તેમની આજાને શીરોધાર્ય માની લઈ આડા અવળા વિચારે બાળુ ઉપર મુકી, તેમને અનુસરવા ખડે પગે તૈયાર જ હોય છે. આ પ્રકારની અનેક વિધ અનુકૂળતા અને સગવડલસી પરિસ્થિતિ છતાં પણ તેમના તરફના પૂરતા માનપૂર્વક હીલગીરી સાથે કહેવું પડે છે કે આ બાળતમાં સામાજિક ઉત્કર્ષ કે અભ્યુદય સાધવામાં ગૃહુસ્થ આગેવાનો જેટલીજ ખલ્કે તેથી વિશેષ આ વર્ગ પણ ઉપેક્ષા અને ઉદાસીનવૃત્તિ જ હાખ્યા છે અને તેથીજ નજીકનો બુતકાળ ગૌરવવંતો જેવાને આપણે ભાગ્યશાળી અની શક્યા નથી. એશક આપણે ઉત્સવો કે ઉધાપનો, પ્રતિષ્ઠા મહોત્સવો કે ઉપધાન પ્રસંગો ધણું ધણું સંપૂર્ણ ધામધૂમપૂર્વક ઉજ્યા પરંતુ સમાજની સાચી ઉજ્ઞતિ

કે સર્વાંગી વિકાસ તરફ જોઈએ તેટલું સમાજના સ- લક્ષ્ય ડેઢાઈએ આખ્યું જ નથી. હીમત સાથે વર્ણિ વીકાસ નિડરતાપૂર્વક કહેવું જોઈએ કે આંગળીના તરફ એ વર્ગ- ટેરવા ઉપર ગણી શકાય તેવા ગણ્યા ની ઉદાસીનતા. ગાંધીયા અપવાદ સિવાય આ વર્ગ સમાજની સર્વહેશીય ઉજ્ઞતિનો કદીપણ વિચાર કર્યો હોય તેમ જણ્ણાતું જ નથી. રાન્ય સર્જક કે વિરોધીઓના આકુમણુ પ્રસંગે તેમાંથી અસ્તિત્વ ધરાવતા ચોતાના તીર્થેને બચાવી લેવા માટેની જૈનસમાજની

શક્તિ કે સામર્થ્યનો ખ્યાલ રાજ્યા સિવાય-સમાજનાં  
સુઅંગ્યા જળમાં ઘટાડો થઈ ગયા છતાં પણ નવા નવા તીથોં.  
ઉલા કરી, તેનો વ્યવસ્થા માટે નવી નવી ચેઢીઓની  
સ્થાપના કરી જૈનસમાજની પોતાના તમામ તીર્થોની રક્ષા  
કરવાની જવાખદારીમાં બેહદ વધારો કરી હેવામાં આવ્યો  
છે. અવિષ્યનો લાંબો વિચાર કર્યા સિવાય આ રીતે પોતાની  
માન અને કીર્તિની બુખને તૃસ કરવામાં આવી છે. ગ્રાચીન  
તીર્થો તો કદક બુલાતા જય છે તેનો ઐવના કરવામાં  
આવી નથી. હાલમાં જ ઉપસ્થિત થયેલ શ્રી કેશરીયાજી  
તીર્થ ઉપરનું ઉદ્દેશુર રાજ્યનું આક્રમણ આપણુને અનેક  
ધા મુંઝાવી રહ્યું છે. તીર્થ ઉપરની શ્વેતામ્ભર પક્ષની સુળ-  
બુત માલેકીનો હક ઉડાડી હેવામાં આવ્યો છે ધ્વજદંડ  
પ્રકરણમાં શ્વેતામ્ભર-દીગમ્ભર પક્ષે વક્ત્વો-ધારીસ્ટરોમાં  
લાંબો રૂપૈયાનો અર્ચ કેસ લડવામાં કર્યો તેના ઉપર પાણી  
ક્રીબી, વરસો સુધી કેસ અભરાઈ ઉપર રાખી સુકી છેવટ  
શુદ્ધ ન્યાયની હાંસી થાય તેવો ઝેંસલો અપાયો છે અને  
કલમના એકજ જપાટે તીર્થના લંડારમાંથી રૂપૈયા પંદર  
લાખની ઉધાડે છોગે ધોળે દીવસે લુંટ કરવામાં આવી છે.  
આ વિષયની વિસ્તૃત ચર્ચા અપ્રસ્તુત છે છતાં પણ રાજ્ય  
સત્તાના આવા આક્રમણે આપણુને અનેક ધાખતોમાં વિચાર  
કરતા કરી સુકે તેવી સ્થિતિમાં સુકી દીધેલ છે. હેવદ્રબ્યનો  
સંથહ-વૃદ્ધિ અને તેના ઉપયોગ મારેના જીવલંત પ્રક્રો  
પાછા તાજા થયા છે અને સંધના નેતાઓની આંખો  
પાછી ખુલ્લી ગઇ છે.

આપણો સાધુ વર્ગ પરંપરાની પ્રણાદીકામાંજ તણું  
ચે જાય છે. ધામધુમ અને હેખાવો કરવાના વ્યામેહમાં  
કેસાઈ જઈ, દીર્ઘ દિવિ કે વિશાળ લાવનાપૂર્વક સાચી  
પ્રગતિની દીશા તરફ નથી કેળવ્યું સામુદ્દર્યીક વિચાર-  
ભળ કે નથી આપ્યું સમાજને સાચું માર્ગ દર્શાન કે નથી  
કોઈ રચનાત્મક કાર્યક્રમનો આરંભ કરાવ્યો કે, નથી દીપા-  
વ્યું સમાજનું નેતાપદ સમાજના વીચારશીલ કાર્યદક્ષ  
પુરુષોએ સર્વાધી દૃષ્ટિથી તેમના તરફ મીટ માંડી કેવી  
કેવી ઉદ્ઘાત લાવનાઓના સ્વરૂપના સેવ્યા હશે તેમાં નિરાશાજ  
પ્રાપ્ત થયેલી જણાય છે.

હજુપણુ 'જાગ્યા ત્યાંથી સવાર'—'બુદ્ધયા ત્યાંથી ફરીથી  
ગણો'—એ સૂત્રો અનુસાર તેમજ Better late than never

ની ઈગ્રેજી કહેવત મુજબ સતકાર્ય કદી  
એ વર્ગ મન પણ હાથ ધરવામાં ન આવે તેના કરતાં  
ઉપર હ્યે તો મોડું મોડું પણ હાથ ધરવામાં આવે તે  
હજુ પણ સુ-વધારે ચોગ્ય ગણ્યાય એ મુદ્દો ઝ્યાલમાં  
માજ પ્રત્યેનું રાખી, તેમના સાધુ ધર્મને લેશમાત્ર ક્ષતિ  
રણું અદા કરી રહેંચાડયા નિવાય સમાજેથાનના

શકે. કાર્યમાં તેઓ ધણું ધણું કરી શકે તેમ છે

પરંતુ તે માટે કંઈક હૃદય પલટાની દિલ્કોણુ (angle of vision)  
અદ્દલવાની અનિવાર્ય આવશ્યકતા છે. કેવળ સંપ્રદાય દિલ્ક  
કે સંકુચિત મનોવૃત્તિઓને લીલાંજલી આપવાની જરૂર છે.  
જે સમાજ ગમે તેવા કપરા કાળમાં પણ તેમની હુરેક

પ્રકારની જરૂરીયાતો અને માગણીઓ પુરી પાડવા માટે હાજારો રૂપૈયાના ખર્ચના લોગે પણ ખડે પગે તૈયાર રહે છે તે સમાજના ઉજવળ લાવીના ઘડતર માટે તેમણે એક પણ તક જતી કરવી જોઈએ નહીં-તે સમાજની સત્ત્યા સાર્વત્રીક ઉજ્વિતિ માટે તેમણે હમેશા પ્રયત્નશીલ રહી સમાજ પ્રત્યેનું રંધુ અદ્દા કરવા માટે પાછી પાની કરવી જોઈએ નહીં

રાજકીય, કાંતિની સાથે સામાજિક કાંતિના લણુકારા પણ વાગી રહ્યા છે ત્યારે સમસ્ત દેશભરની વિશાળ સમાજનું

આપણો નૈન સમાજ પણ એક માત્રાનું પ્રત્યેક વ્યક્તિની કોમ તરીકે મુખ્ય અંગીભૂત તત્ત્વ હોવાથી ની ફરજ તેમજ આપણી સ્વતંત્ર નૈન સંસ્કૃતિની

એક વિશિષ્ટ સંસ્કૃતિ તરીકે ગણુના થતી હોવાથી આપણે ડેવળ ઉજસીન વૃત્તિ ધારણુ કરી, કુંલકર્ણિની નીરામાં સુશુદ્ધ દશામાં ઘોયો કરીએ તે શોલાસ્પદ ગણી શકાય નહિં. આવા અનુકૂળ વાતાવરણમાં તો આગળ વધનાર માટે ઢાળ આવ્યો છે માટે મને કે કમને હોડવું જ પડશે એની ગણુના રાખી સમાજના આગેવાળોએ-ભાલેને ગૃહસ્થ હોય કે સાધુ હોય-પ્રત્યેક સમાજ ઉજ્વિતિના યજા-કાર્યમાં પોતા તરફનો સર્વશ્રેષ્ઠ-યશ્વરી ફાળો તન, મન અને ધનથી અવશ્યમેવ આપવોજ જોઈએ.

શ્રી વીર પરમાત્માની ‘સવીણું કરું શાસન રસી’ ની ઉદ્ઘાત લાવના વીરના સંતાનો તરીકેનું જીરવ ધરાવતા

આપણે ખરેખર કુલીતાર્થ કરવી હોય. તો  
**વસુધૈવ કુદુ:** વસુધૈવ કુદુમણકની ભાવના પુર્ણ સ્વરૂપ  
 બની ભાવના ખીલવવી જોઈએ પરંતુ તે રહેતાં સાચી  
 પરમાર્થ વૃત્તિથી વસુધૈવ કુદુમણક અને  
 સ્વામિવાત્સલ્યની વિશુદ્ધ ભાવવાનું સાચું સ્વરૂપ આપણે  
 સમજી લેવું જોઈએ. માન-પ્રતિષ્ઠા કે કિર્તિની લુખ સંતો  
 ષબ્દ હારો રૂપૈયાના ખર્ચે સ્વામિવાત્સલ્ય કે નોકારશી  
 કરનારા ગૃહસ્થની પાસે આવા સંઘ જમણુંને બીજોજ દીવસે  
 કેળવણી મારો કે ઉદ્યમે ચડવા મારો કંઈક મહાની માર્ગણી  
 કરવા જનારને કેવો નિરાશાજનક જવાણ મળે છે તે ધણા  
 લાગ્યોના અનુભવનો વિષય છે. હવે તો આપણુંને કાળ  
 ખળના પ્રતાપે વિધવિધ પ્રકારના અનુભવ પૂર્ણ અનેક ખોધ  
 પાડોના પ્રભાવો, સાચું માર્ગદર્શન મળતાં સમજાવું જોઈએ  
 કે કેવળ નિઃસ્વાર્થ બુદ્ધિથી, પરમ સેવા ધર્મની વૃત્તિથી,  
 તન, મન અને ધનથી સમાજ ઉત્થતિના સુર્વીંગી વિકાસ

કાર્યને યત કિંચત્પણું આગળ બાવનાર  
**કૃષ્ણ-રખમો** સ્વામિવાત્સલ્યની ભાવનાને ચારે ખાંલુથી  
 માં ધરમુળના પુષ્ટ નનાવી રહેલ છે. આ રીતે અનેક બાળ-  
 ક્રીસ્ટિયની જરૂર તોમાં પરંપરાગત પ્રણાલીકા અને રૂઢિ  
 રાહ-રક્ષમોમાં આપણે ધરમુળથી ધણા ધણા  
 ક્રીસ્ટિયા કરવાના રહે છે. સ્થિતિયુસ્ત અને રૂઢીયુસ્તા બાઈએનું  
 આખું દૃષ્ટર ( Point folio ) વિશારદ સમાજશાસ્કોની બાઈકે  
 નજરની જરૂરીક્ષા. અને સમાવોચના પર્વની સ્વાર્થ સુરી મારી  
 રહેલ છે, આપણું જરૂરી સુધારાણ કાર્ય સક્રીની જરૂરાણ કરતે

ઉધાપણુપૂર્વકની અનતી ત્વરચે હાથ ધરવા પ્રમાણાસ્ત્ર  
રહીયું તો પછી પરિવર્તનશીલ જમાનાના પ્રભર બાળને  
અગરતો રાષ્ટ્રીય પ્રજાકીય સરકારની રાન્ધ્યસત્તાના પ્રતાપને  
આધીન થઈ લાચારીથો સામાજિક સુધારા આપણે સ્વીકારી  
દેવા પડશે અને તે વર્ણતે ઘણું મોડું થયું હશે.

નૈનધર્મ અને જૈનસમાજની પ્રાચીન-બુતકાળીન  
જ્વાઙ્કાજલાલીનો, અર્વાચીન પરિસ્થિતિનો, ઉત્તરાતર ક્ષીણ  
થતી જતી આપણી સામુદ્દર્યોક શક્તિનો, વર્તમાન દશાનો,  
સમાજનું સુકાન કેવું મહાનુભાવ પુરુષોને સોંપવું જોઈએ  
તે ખાખતનો આગેવાનોના ગુણ-હોષ અને તૃટીઓના સવિ-  
સ્તર વીવેચન સાથે કાર્યસિદ્ધ માટે સમાજને તેના પ્રત્યેક  
અંગીભૂતો—મેમણરોના મહદની કેટલી ખાંડી જરૂર છે તો  
ખાણેનો, સમાજની અવનત દશા થઈ પડવાના કારણો વરો-  
રેનો આપણે સર્વચાહી દૃષ્ટિએ વિચાર કરો. હવે આધુનિક  
સમબને અનુલક્ષીને અરાણર લક્ષ્યમાં રાખીને બાંધોનો ઉત્કર્ષ  
કેમ થાય, તે ખાંગે કંઈક સમાવેચના મનનપૂર્વકની વિચા-  
રણા કરીએ. બુતકાળના સર્વદેશીય અતુલબને આગળ  
કરી નજર સન્મુખ રાખી, જૈનેતર સમાજો કંઈ રીતે આગળ  
લાધી રહી છે તેનો વિશાળ દૃષ્ટિશી ખરાખર અભ્યાસ કરી  
આપણું ઉત્કર્ષ માટે ધર્મ અને સમાજના ઉજવણી ભાગિન્ય  
ધડતર માટે કંઈક સુંગીત ચેતાચ્ચો લાયાર કરી જો  
સુભાજ સન્મુખ ચેતાચ્ચ વિચારણા અને ચર્ચા માટે રહ્યું  
કર્યાની રહે છે. પ્રથમ દુર્જાચે આસુદ્ધીક બિલ્થીસ અને  
ઉત્કર્ષ માટે સમાજનું ચિન્પાદું ખાંગ કેળવુલાની લસજિસિં

જરૂર છે. કુદકે અને ભુસકે આગળ વધતી નૈનેતર સમાનોની હરેળામાં રહેવા જેવી સ્થિતિ પ્રાપ્ત કર્યા પણી જરૂર કંઈક આગળ વધવાનો વિચાર કરી શકાય. નવયુગના આજમાનામાં સાર્વત્રીક ઉત્કર્ષ માટેના અનેકાનેક પ્રગતિ સાખેનો આપણું સંમુખ ભર્યા પડ્યા છે તેનો બરાળર પુરૈપુરે ઉપયોગ કરવામાં આપણે જરા પણ કચાશ રાખવી જોઈએ નહીં. પ્રમત્ત કે સુશુપ્ત દશામાં એ પરવાધથી પડ્યા રહેવાનું આપણું હું પાલવે તેમ નથી.

શાજકીય, ઔદ્ઘોગિક, ધાર્મિક હેસામાણક તમામ ક્ષેત્રોમાં આગેકૂચ માટેનો સામુહાયિક હૃતિવર્તમાન સ- ચાલો એને પ્રવૃત્તિઓની ધરખમ ચોજનાએ અથનું અનુકૂળ તથાર કરી. તેનો રૂપ-રેખા અનુસાર આગેવાતાવરણ, કદમનોજ આ જમાનો છે. સહ્યકાર અને સંગઠન પૂર્વકની સામુહાયિક પ્રવૃત્તિ જ, સાચું માર્ગ દર્શન અને હૃદયપૂર્વકની સેવાભાવી આગેવા-નેનો દોષવણી મળતાં સહેલાધથી કાર્યસીદ્ધ કરી શકે તેમ છે. સચેત અને જાગ્રત થછ જેરથી ખારણા ખખડાવવાની જરૂર છે. નાના તળાવ કે મોટા સરોવરમાં એકાં નાની કંદરી ઝેંકવા માત્રથી તે જગ્યાએથો પાણીના કુંડાળા વળવાની શરૂઆત થતાં તે છેવટ ચારે ખાળુના કીનારા સુધી ઝેલાતા જાય છે સુદ્ધાની હકીકત ધ્યાનમાં રાખીને સમાજના આગેવાનોએ પ્રત્યેક ખાખોમાં આનદોલનો જરૂર હેતા કરી હેવાનો જરૂર છે દેશભરની વર્તમાન પરિસ્થિતિ જેતાં દેશ-કાળના પરિવર્તનો સર્વ રીતે આપણું મહદુદ્ધ કરવા તથાર છે.

તો એક પણ તક નિરથી જવા હેવી જોઈતી નથી.

ધાર્મિક તેમજ સામાજિક ઉત્કર્ષના મહાલારત કાર્યભાં  
દેશસરનાં જૈનસ્વયંસેવકોની અસાધારણું  
સેવાભાવી મહદું મેળવવાની જરૂર છે. તેઓનો સાથ  
અને કાર્યદક્ષ અને સહકાર, તેમણે વ્યવસ્થાપૂર્વક મેળ-  
નેતાઓની વેલી તાતીમ અને જમાવેલી તાતીદ્વારા  
પ્રાથમિક પ્રવૃત્તિએ તેમનો હૃદયંગમ સેવાભાવ અને  
જરૂરીયાત ઉત્તમશીલતા (discipline) તેમનું વિનીત  
અને નિડરતાપૂર્વકનું વર્તન, ખડતલ  
શારીરિક ણાંખારણું-વગેરે અનેક ણાણતો સમાજનું વિચાર-  
ણગ કેળવવામાં, તૈયાર કરવામાં આવેલ ચોંજનાઓની રૂપ-  
રેખા સમજવવામાં, આણુણાજુના વાતાવરણુંને દરેક રીતે  
અનુકૂળ બનાવી લેવામાં, રચનાત્મક કાર્યકુમને આગળ  
ધ્યાવવવામાં આપણુંને ધણી ધણી રીતે મહદગાર અને ઉપ-  
ચોંગી થઈ પડશે. આવા નવલોહીયા-ઉત્સાહી યુવાનોને  
સાચી હોરવણી આપવા માટે સાચા દીલના, સેવાભાવી,  
વ્યવહારકુશળ અને કાર્યદક્ષ આગેવાનોની આપણે પ્રથમ  
દરજને હેઠી જરૂર છે. તેવા આગેવાનો મોટી સંખ્યામાં  
એકદમ ન મળી શકે તે ખનવા જેગ છે તેમ છતાં પણ  
રાષ્ટ્રીય ઝીલચાલની આગે કુચમાં દેશસરની તમામ પ્રજાઓ  
સાથે હાથમાં હાથ મીલાવીને જૈનપ્રજાએ પણ સારો ઝાણો  
આપ્યો છે તે જેતાં, ચુદ્ધ સમયે જ્યારે ચુદ્ધની નોણત ગડબડે  
છે, દેશ ભરની પ્રજને હુક્કા કરતાં રણુશીંગડાં કુંકાય છે  
અને ભાઈ-ચારણો (પુરાતન કાળના ચુદ્ધ સમયના મુખ્યપત્રો)

ખીરહાવલી જેશબેર લલકારે છે ત્યારે ક્ષાત્રતેજ ધરાવતા—  
ક્ષાત્રવટ જળવી રહેવા નવદોહુાં યુવાનો આપોઆપ રણ-  
મેદાનમાં હિંમતસેર ઉતરી પડે છે તેની માઝુક જ આ નવ-  
ચુગના કંતિકારક જમાનામાં સામાજુક કંતિ માટેનો શાખ-  
દ્વાની થતાં, સામાજુક ઉત્થાન માટેની ગગનલેદી ગર્જના  
શ્રતાં, આગેકઢમના સ્ત્રોને પડકાર થતાં, સત્તવહીન ડાચા  
પોચા—માયકંગલા સ્વાર્થનિષ્ઠ આગેવાનો ને ધકેદી પાડી,  
જોઈએ તેવા જ સાચા, સમર્થ, તેજસ્વી પ્રમાણીક અને  
સેવાલાવી આગેવાનો આપોઆપ આગલી હુરૈણમાં આવી  
રણમેદાનના મોરચાનું તેમનું ચોણ્ય સ્થાન સંલાખી લેશો  
એવી આશા તદ્દન અસ્થાને જણુાતી નથી.

સમાજ—ઉત્થાનના પ્રારંભકાળમાં—શરૂઆતમાં આવી

કેટલીએક મુશ્કેલીએ ઉલ્લી થવાની જ  
મુખ્ય મુખ્ય તેનો સામનો કરવા માટે આપણે તૈયાર  
કેન્દ્રસ્થાનોમાં રહેવું પડશે અને લાવી વધારે ઉજજવળ  
સ્થાપવા અને જીવલંત ણનાવવા માટે આગેકુચ  
જોઈતા સેવા- માટેના તમામ પ્રણળ સાધનોનું સંગૃહન  
મંડળો અને કરવા સમાજની તમામ વ્યક્તિએનો ઉલટ-  
સેવાસર્વનો લેર સહુકાર મેળવવા તેમજ થનગનંતા  
સેવાલાવી યુવાનોને તેમજ ઉત્સાહી સ્વયં-  
સેવક લાઇએને સીધું અને સરલ માર્ગદર્શન આપવા સાચી  
હોરવણી આપવા માટે મોટી સંખ્યામાં જોઈતા આજેવાનો  
મેળવવા મુખ્ય—અમહાવાહ જેવા જૈત કેન્દ્રસ્થાનોમાં લોક-  
સેવા સમાજ કે સર્વનાટસ્ર એક ધનીયા સેસાધી જેવી

જૈન સંસ્થાઓ—જૈન સેવામંડળો અને સેવાસદ્ધનો ઉલા કરવા પડશે. જૈન ધર્મ અને જૈન સંધની સાર્વત્રીક ઉત્ત્રતિની સાધના જેવા પરમ ઉપકારક અને એકાંત હૃતિકારી કાર્ય માટે સાધુ વર્ગ તરફથી આપણે લેખીએ તેટલી મહદુદ્ધ મેળવવા ભાગ્યશાળી થયા નથી એટલે આવી સંસ્થાઓની તાત્કાલીક આવક્ષયકતા અનિવાર્ય જણાય છે. ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ તરફથી તાજેતરમાં જ ઉલ્લું કરવા ધારેત સેવાસદ્ધન તરફ આ પ્રસંગે સલામતીથી અંગુલી-નિર્દેશ કરી શકાય.

આવા સેવાસદ્ધનો પ્રત્યે મહોટા મહોટા શહેરોમાં સ્થાપન કરવાની જરૂર છે. જુંદગીબર-મરણુપર્યાંત-જૈન ધર્મ અને જૈન સમાજની તદ્દન નિઃસ્વાર્થ વૃત્તિથી સેવા કરવાનું ગ્રત લેનારા, શ્રી જૈન સંધનું શાચું અને અનેક હેરીય સ્વામીવાત્સલ્ય કરવાની પ્રતિષ્ઠા લેનારા, પોતાનું સર્વાનું જૈન સમાજ ( ચતુર્વિધ જૈન સંધ ) ને ચરણે ધરી હેનારા ભાઈઓ ત્થા બહેનાના મંડળો ઠેક ઠેકણે છલા કરવાની જરૂર છે. સેવાવૃત્તનો લેખ ધારી આ વર્ગ ગૃહસ્થ અને સાધુ સમુદ્ધાય વચ્ચે સાંકળની કદી રૂપ ખની રહેશે અને ધાર્મિક તેમજ સામાજિક ઉત્ત્રતિના કાર્યનો ચેગ ચુર જેસથી વધારી શકશે.

આ સ્થાને નિડરતાપૂર્વકની હીમત સાથે કહેવાની જરૂર જણાય છે કે ચતુર્વિધ જૈન સંધમાં અશ્વસ્થાન ધરા-વતા સાધુ વર્ગ નિર્દ્ધક ચર્ચાઓ, વાદ-વિવાદો અને જાંદર-

એ દરની કલેશવર્ધક અગડાયોરી અને અંગત આશ્રેપાતમક ગલીચ પ્રવૃત્તિઓમાં જેટલા સમયની, શક્તિની અને દ્વયની વારળાદી કરી છે તે જે ધાર્મિક અને સામાજિક ઉજ્ઞતિના માર્ગ વયરાય હોત તો જૈન સંઘની વર્તમાન પરિસ્થિતિ કંઈક અવનવીજ લાત પાડી રહી હોત. જન સાધુ ઉપહેશજ આપી શકે પણ આહેશ કરી શકે નહી એવી કોઈ ફલીલ કદાચ તેમના લચાવમાં આગળ કરવામાં આવે તો તે ઘડી ભૂરુ પણ ટકી શકે તેમ નથી. તેમનો ચાલુ વ્યવસાય અને અનેક વિધ પ્રવૃત્તિઓનું ખારીક નિરિક્ષણ કરવામાં આવતા સાંકે આંક જેઠ શકાશે કે તેવી પ્રવૃત્તિઓ કરતાં ધાર્મિક અને ગ્રામાજુક ઉત્કર્ષનું કાર્ય જૈનશાસનના જ્વલંત ઉદ્ઘોતમાં પરીણુમતું હોવાથી શતગણું કલ્યાણુકારી અને સ્વ પર હીત-ગુંધક હોવાથી પરમ ઉપકારક કાર્યોની કોટીમાં મુકી થકાય તેમ છે એટલે ઉખરોક્ત ધાર્મિક સિદ્ધાંતને લેશમાત્ર પણ ક્ષતિ હોંચાડયા સિવાય તેઓ જૈનધર્મના અને શ્રી સંઘના ઉત્કર્ષ માટે ઘરું બણું કરી શકે તેમ છે અને ધર્મના ઉદ્ઘોતના કાર્યમાં તેમજ શ્રી સંઘની સાર્વત્રીક અભ્યુદયની દિશામાં તેઓ ધારે તો મહોટો ફ્રાણો આપી શકે તેમ છે. ભુતકાળના ઔરવવંતા સમયમાં આ વર્ગ તરફથી સામાન્ય પ્રસંગે કે શાસન ઉપરના આકમણું પ્રસંગે જયવંતા જૈન શાસનના ઉદ્ઘોત મારોએ અને જૈન સંઘના રક્ષણ નિમિત્તે જે જે મહાન્ કાર્યો ઉપાડી લેવામાં આવ્યા છે તે બધાની ગણુના કરવા જેસીએ અને તેના સવિસ્તર વિવેચનમાં ઉત્તરી જહીએ તો લેખ ધણ્ણો લાણો. થઈ જવાનોં લય રહે છે એટલે જ તેના નિર્ણય માત્રથી જ સતોષ માનવાનો રહે છે.

આધુનિક સમયને તેના ખરા સ્વરૂપમાં, વિશાળ દૃષ્ટિથી ચર્વાંશાહી નજરથી દેશ-કાળના યથોચીત વિચારપૂર્વક અરાખર ઓળખી લેવો જોઈએ અને તેમ થાય તોજ વર્તમાન સમયના તમામ અનુકૂળ સાધનોનો પુરેપુરો લાલ લઈ શકાય-વિવેકપૂર્વક તેનો ઉપયોગ કરી શકાય. ધાર્મિક સાહિત્યના પ્રકાશન અને પ્રચાર માટે પણ પરંપરાને કેવળ સંપ્રદાય દૃષ્ટિને ખાંચુ ઉપર રાખી અનેક જૈનેતર સંસ્થાઓ જે રીતે ધાર્મિક ઉદ્ઘોતનું આવું મશસ્ય કાર્ય આગળ ધ્યાવાની રહી છે તેનો તેમજ જે રીતે સામાજિક સર્વાંગી વિકાસ સાધી રહી છે તેનો ખરાખર-સારથાહી નજરથી અભ્યાસ કરો ધાર્મિક અને સામાજિક ઉજ્વલિનાં કાર્યમાં પ્રત્યેક જૈન ધ્યક્તિએ-સાધુ, સાધ્વી, આવક કે શ્રાવિકા-ફરેકે પોતા રારક્ષનો વિશિષ્ટ ઝાણો આપવા કમર કસવી જોઈએ.

કેવળ આત્મ કલ્યાણના માર્ગમાં જ મન્ત્ર રહેનારા, સમાજના નિકટ સંસર્ગમાં કદીપણું નહીં આવનારા, સમાજથી ફર નહીં પ્રાયે જંગલોમાં કે પર્વતની ગુફાઓમાં જ વાસ કરીને જ્ઞાન, ધ્યાન અને યોગાભ્યાસમાં આગળ વધનારા, ભમતા રામ જેવા અભ્યુત યોગી શ્રી આનંદનજી કે શ્રી ચિહ્નાંદજી ઉર્દ્વે કર્પુરચંદજી જેવા સાધુ પુરુષોનો પ્રક્ષતો તદ્દન નિરાણો અને બુદ્ધો જ છે કે તેઓ પણ પોતાના શાસ્ત્રીય અભ્યાસ અને યોગસાધનાથી પ્રાહુલ્ભૂત થયેલ અને વૃદ્ધિ પામેલ અપૂર્વ અનુભવ (જેને તેમના પદોમાં એક કાયમના મિત્ર તરીકે ઓળખાવેલ છે) નો સમાજને અમુલ્ય લાલ પોતાની કૃતિઓથી અને જીવન-

ભરતના પ્રથમ આદર્શિકૃપ ચારિત્રથી આપી ગયેતું છે. ણાણી ભજ્ય-આલીશાન મહાલયોમાં રહેનારા, સમાજ સાથે ગાડ અન્ગર્માં આવનારા-પોતાના દષ્ટિરાળી ભક્તજનો આશેનો રૂપ્તપ્રતિમ લંપડ સાધનારા-ખાનગી ગોધીએ અને ગુરુ-નગેમાં મશગુલ રહેનારા, સારા હી નભર વિષીએ ચલાવના, લાલિક-શ્રુતિ ધનિક વર્ગ ઉપર અનેક પ્રકારની ભરતા અને વર્ચેસ્વ ધરાવનારા સાધુ સમુદ્દર પાસેથી તો જૈન સમાજ પોતાના ઉત્કર્ષ અને અલ્યુફય માટે અનેક પ્રકારની વિધ વિધ આશાએના કીલ્વા બાંધે એ તદ્દન દુલાલાલિક અને યોગ્ય જ છે. તેમનો ઉપદેશ-તેમની દોર-વૃણી-તેમનું માર્ગદર્શન સમયસરની ચેતવણી, સહૃદય સાથ અને સહૃઠાર આપણને અનેકધા ઉપયોગી અને હૃતકર ધર્ય પડે તેમ છે. પરંતુ વો હીન કબ ?

પ્રથમ દરજને-હાલ તુરત સમાજની પ્રત્યેક વ્યક્તિને-સાધુ-સાધી, શ્રાવિકાને સમાજ પ્રત્યેની અનેક-વિધ જવાણદર્શિનો અને ઢણુનો સાચો જ્યાલ સચ્ચોટ કાંચ થવો થવો જોઈએ.

અનેક પ્રકારના પ્રત્યાધારી-વિરોધી બળોની અને કુદરતી કોપની વિનાશજનક આંધીએમાંથી અન્ધાર કાર્યમાં આપણે અનેક વખત પસાર થવું પડયું હોનેતર સંસ્થા-છે છતાં પણ અહુભાગ્યે આપણે ઉત્તરોત્તર એના સુકા-વારસામાં મળેલું જે કંઈ ધાર્મિક સાહિત્ય અન્ધે આપણો ગણ્યા શક્યા ઈએ-જળવી રાજ્યું છે તે

સ્વરૂપ જણુતો અલિમાન અને ગૌરવ દેવા કેવું છે અને  
પ્રયાસ તે હવે આપણે આ જ્ઞાનયુગના જમાનામાં  
ઉદ્ઘારસાવે હુનિયાલરમાં પ્રચાર કરવાનું છે.

છેલ્લા ૫૦-૬૦ વરસોમાં આપણે આ દીશામાં કંઈક ઠીક  
ઠીક કરી શક્યા છીએ પરંતુ ઈતર-ધર્મિઓના મુકાણલે  
આપણેં. પ્રયાસ ધર્મા મંહ અને અલંપ છે. જુદા જુદા  
પરદેશી કીર્તિયનમીશનો હુનિયાના હુર હુરતા દેશોમાં હારેના  
માઈલોની સુસાદરી કરીને, અનેક પ્રકારના જોખમો જેડીને  
ખેણ્યો ગયા છે અને લાખો કરોડો રૂપેયાના ખર્ચ પોતાના  
ધર્મિક સાહીત્યના પ્રચાર માટે અને પોતાના ધર્મથંધુઓની  
સંખ્યામાં વૃદ્ધિ કરવા માટે અનેક પ્રકારની ચુક્કિ-પ્રચુક્કિતઓ-  
પૂર્વક પારવાર જહેમત ઉડાવી રહ્યા છે. સેંકડો ભાષામાં  
ખાઈળસના તરઙ્ગુમા કરાવી કરોડોની સંખ્યામાં તેની સેંકડો  
આવૃત્તિઓ ખણાર પાડી ચુક્યા છે. ડેર ડેર તેમન ઊપરે-  
શકો ધુમી રહ્યા છે. જીવન નિર્વાહની તેમજ ખીલુ અનેક  
પ્રકારની લાલચો આપી સ્વધર્મીઓની સંખ્યાળળમાં પણ  
વૃદ્ધિ કરી રહ્યા છે. મીશનરી કોંગ્રેસમાં અને પ્રાઈમરી  
સ્કુલો, નીડલ સ્કુલો અને હાઈસ્કુલો, કન્યાશાળાઓ  
વગેરેમાં ફરજીયાત ધર્મિક શીક્ષણ આપી રહ્યા છે. મહોટી  
મહોટી હોસ્પિટ્લો ચલાવી લાખો મનુષ્યોને ઉત્તમ પ્રકારની  
બૈદ્ધીય સારવાર અને સગવડ આપી પોતા તરફ આકર્ષી  
રહ્યા છે. આ બધું આપણે એકીટશે નીહાળી રહ્યા છીએ-  
તેનો લાભ પણ લઈ રહ્યા છીએ છતાં તેમાંથી જોઈનો બોધ-  
પાડ અહુણું કરી તે દીશામાં હજુ પ્રયાણ શરૂ કર્યું નથી.

આવી પરગનુ ધર્મદા સંસ્થાએ। ઉલ્લી કરવા પાછળ તેમજ તેને ચલાવવા પાછળ લાએ। રૂપેયાનું ખર્ચ કરવામાં આવે છે તેવા ખર્ચની પાઈએ પાઈ રસાળ ભૂમિમાં વવાતી હોઈ ઉગ્ણી નીકળે છે અને અનેક ગણ્ણી ઝગણાઈ થઈ પડે છે. આપણી નૈન ડોમ માતરણ ગણ્ણાય છે, વળી આપણી સમાજમાં કરોડપતિઓ અને સેંકડો લખપતિઓ તેમજ લાએ। રૂપેયાના ટ્રેસ્ટ ઇંડો છતાં આપણને તેના સફુલિપ-ચેણના દીશા જ હણુ સુજ નથી. કેવળ પરંપરાથી ચાહ્યા આવતા રૂઢ પ્રવાહમાં જ તણ્ણાયા જઈએ છીએ. એકના એક ગાડા ચીલામાંથી ચાતરવાની હીંમત કે શક્તિનું દીવાળું જ કૂંકચું છે. હીંહુ ભાઈએ જેટલી પણ જાત્રત્વ કે વીવેક-ભુદ્ધિ આપણે ખતાવી શક્યા નથી. તેમને સુકાણલે આપણે કંઈક વામન જ હેખાઈએ છીએ.

સાહીત્યપ્રચાર અને જ્ઞાનવૃદ્ધિના કાર્યમાં સંસ્કૃતા સાહીત્ય વર્ધક કાયાલય તરફથી બિલ્લુ અખંડાનંદ જેવા પ્રખર શક્તિશાળી કાર્યકરની ગુવનહરની અખંડ અને અવિરત સેવાના પરિણામે કેટકેટલા દળદાર પુસ્તકોની કેટલી સંખ્યામાં કેટલી આવૃત્તિએ ખણાર પાહવામાં આવી, જન સમાજે તદ્દન નજીવી કીંમતથી મળતા પુસ્તકોનો કેટલો ખધો-કેટલા મોટા પ્રમાણમાં લાલ લીધોં અને લીધે જય છે તેનો વિચાર કરવાની પણ આપણને કુરસદ નથી. પુસ્તકોની કીંમત નજીવી રાખ્યા છતાં પણ સદર સંસ્થાનું ટ્રેસ્ટ ઇંડ લાએની ગણ્ણતરીથી અંકાય છે તે કંઈ ઓછું ગૌરવપ્રદ નથી, સદર સંસ્થાના ઓદ્ઘોગિક કાર્ય કુશળતાના તેસજ

વિરલ સાહસીક પ્રવૃત્તિના પરીણુમે હજારો વાંચન-શોખીન અંધુએ ધણુએ આછા ખર્ચે એક નાની સરખી અંગત-ખાનજી લાખશ્રેરી ઉલ્લી કરી શક્યા છે. આ સંસ્થા તરફથી પ્રગટ થયેલ પુસ્તકેની પસંદગી પણ ધર્મના અને નીતિના ઉચ્ચયતમ ધોરણે થયેલી હોવાથી તે પ્રશંસાપાત્ર થઈ પડેલ છે. આ બધું સાહુસ સંસ્થાના આત્મારૂપ બિલ્ખુ અખંડાનંદને જ આલારી છે.

હીંદી માસીક ‘કહ્યાણુ’ના પ્રયોગેઓ અને પ્રથાંધ કરતાઓ તરફથી પણ અમેક પુષ્ય પ્રસંગો અને ધાર્મિક તહેવારોના પ્રસંગો અડપી લાર્ડ, ખાસ-દિશિષ્ટ-સેંકડો પુષ્ટોના દળદાર અંકો હજારોની સંખ્યામાં આકર્ષક રીતે ખહાર પાડવામાં આવ્યા છે અને તેનો અપૂર્વ લાભ ધણી મોટી સંખ્યામાં જનસમાજ લઇ રહેલ છે તેનું પણ હજુ આપણે આછું-પાતળું અનુકરણુ કરી શક્યા નથી. ‘પ્રભુદ્ધ જૈન’ જેવા પ્રૌઢ-મનનીય-શિક્ષાપ્રદ-ઉંડી વિચારણા માગતા ઉપયોગી લેખોને જ સ્થાન આપતું પ્રખર પાક્ષિક પત્રને આપણે ધરાણર અપનાવી શક્યા નથી. ઉત્સવો અને ગ્રવેશ મહેત્સવો વરદોડા અને સામૈયા જેવા પ્રસંગોના ભલકલર્યા અતિશયોક્તિપૂર્ણ વર્ણનોથી પાના લરતા પત્રોથી-લરતીયા જેવા લખાણોથી સંતોષ માની આપણે કુલાર્ધ જઈએ છીએ. નૈન સમાજના મોટા ભાગની મનોદશા આ બાળતમાં હજુ ઉંચ્ય કક્ષાએ પહેંચી નથી. સાક્ષર-સીદ્ધહસ્ત લેખકો પાસે, યોગ્ય પુરસ્કાર આપીને પણ વિદ્ધતા-પૂર્ણ લેખો તૈયાર કરવાની તેનો ખેણો પ્રચાર કરવાની

વૃત્તિ હજુ આપણામાં ઉદ્ભવી જ નથી. ઉત્તમ અભિરૂચી  
 ધરાવતો વાયક વર્ગ પણ હજુ મહોટી  
 કેવું પ્રકાશન સંખ્યામાં ઉલોં કરી શક્યા નથી આપણા  
 હાથ ધરવાની માર્ગીડો કે પંચ જૈનેતર વર્ગને, સાક્ષર  
 જરૂર છે તેનું બંધુઓને હજુ આકષી શક્યા નથી જન  
**દીગું દર્શન** સમુદ્ધાય તેનાથી હર રહેતો જ જાણાય  
 છે-ધણે અંશે માહેતી પણ ધરાવતો નથી  
 આવા સંચેંગો વચ્ચે સાહીત્યપ્રચાર અને જ્ઞાનોદ્ધારના  
 કાર્યમાં આપણે હજુ ધણું ધણું કરવાનું રહે છે. જૈન  
 તેમજ જૈનેતર સમાજમાં પણ ઉત્તમ છાપ પાડે-વખતો  
 બખત માગણી થતી રહે અને શિક્ષીત વર્ગમાં તેને માટેની  
 અભિરૂચિ વધતી જય હિન પ્રતિહિન વધતા જતા વાંચનના  
 શૈખને પુરતી તૃપ્તિ મળે, ધાર્મિક અને નૈતિક જીવન, વિશુદ્ધ  
 ચારિત્રપૂર્વક વિકાસકરણમાં આગળ વધતું રહે, તેવા  
 વિદ્વાલોભ્ય તેમજ લોકલોભ્ય પ્રકાશનો પાણીના મુલ્યે  
 મસિદ્ધ કરવા માટેની વ્યવસ્થા ધપાવી રાખવી જોઈએ. આવા  
 પરમ ઉપકારક અને જન હીત તેમજ લોક કલ્યાણના વૃદ્ધિ  
 કરી શકે તેવા સાહીત્ય પ્રકાશન અને જ્ઞાનવૃદ્ધિ માટેના  
 લંડેણો અને ઝંડેનો ઉપયોગ વીવેકપૂર્વક અને તરતમતાની  
 દૃષ્ટિથી વીશેષ લાલદાયક રીતે થવો જોઈએ. દાન પ્રવાહની  
 અતિ-સરણી આવા ઝંડેની વૃદ્ધિ તરફ તેમજ નવા ઝંડેની  
 સ્થાપના તરફ વાળવી જોઈએ અને આવા ઝંડેને ખાસ  
 શીજર્વ ઝંડેની માર્ગક તદ્દન સુસુસ દશામાં નહિ રહેવા હેતા  
 તેમજ વ્યાજ વગેરેથી કેવળ તેનો વૃદ્ધિ કરીનેજ સંતોષ

નહિ માની લેતાં તેના કેવળ સંગ્રહ-સંઅહ અને વૃદ્ધિનું જ લક્ષ્ય નહીં રહ્યતાં, તેનો સતત ચાલુ ઉપયોગ ચોણ્ય વ્યવસ્થા અને વીવેકપૂર્વક નીરંતર કરતા રહેવું જોઈએ. સાચી શીશામાં પ્રમાણીકપણે અને ઉત્સાહપૂર્વક કામ કરનારાએ. મેળવવાની લેટલી સુશીળત છે તેટલી આવા કાર્યો માટે આર્થિક મદ્દદ મેળવવામાં નથી વખ્ચિકુભુદ્વિધી પોતાના દ્રવ્યનો હાનમાર્ગે ઉપયોગ કરનારાએ. વ્યજ્ઞસ્થા-પૂર્વક થતા કાર્યની ચોણ્ય તુલના કર્યા પછી જ પુખ્ત વિચાર કરીને જ હાન કરવા પ્રેરાય છે. કાર્ય કરનારના અભાવે કંબચિત્ કામ અટકી પડે છે પરંતુ નાણુની સુશ્કેલીથી સુદ્ધ્યવસ્થિત કાર્ય અટકી પડતું નથી. કામ કરનારાએની સમાજમાં કંઈક પ્રતિષ્ઠા જન્મયા પછી તો નાણુ મળતા જ રહે છે છેલ્લા વિશ્વચુદ્ધ દરમીયાન તેમજ તે પછીના સમયમાં કેટલાક લાઇએ. ધાર્યી સારી કમાણી કરી શક્યા છે તેમની પાસેથી ચોણ્ય મદ્દદ મેળવવાની સમાજ કંઈક આશા રાખે એ તફન સ્વાભાવિક છે. સમાજના અથગણ્ય નેતાએ પાસે એકદું થયેલ દ્રોગ અમુક દાખિએ સમાજના આધુનિક રીતવા ઇંડ્રિય ટ્રૂસ્ટ જોવું છે. અને તેના ધનિક પાસેનું માલીકને ટ્રૂસ્ટી તરીકેની સ્થિતિમાં ગણ્યી તેના સંઅહીત દ્રવ્ય સહઉપયોગ માટે દ્યાણ કરવા અને તેનો ટ્રૂસ્ટફુંડ જોવું છે ફ્રેન્પયોગ થતો અટકાવવા સમાજ હક્કાર એટલે ધનિકો છે. એવી માન્યતાનો જ માનો નજીક આવતો તેના ટ્રૂસ્ટી છે જય છે. સહભાગે-પુષ્યઅળે પ્રાપ્ત થતા ધનનો માલીક પોતાને ટ્રૂસ્ટી તરીકે ગણ્યો અને સહર

ધન પ્રાપ્તિમાં તેના કુદુર્ભીજનોની માફક સામાજિક ખંડુઓનું ભાગ્ય પણ કંઈક અંશે કામ કરી રહ્યું છે એવી માન્યતા ધરાવતો ધનિકવર્ગ થાય એ ખાસ ઈચ્છિવા ચોગ્ય છે. આવા ઉદાર દીલના ખંડુઓ જ સહલાંયે દાનેશ્વરીનું પદ પ્રાપ્ત કરી શકે છે. સમાજ આવા ખંડુઓ તરફ જ પોતાના સાચા અભ્યુદ્ય મારે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક મીટ માંડી રહેલ છે.

**ધર્મનો સાચ્યા ઉત્કર્ષ** અને ઉજ્ઞતિ એક હાથમાં તલવાર

અને ખીલ હાથમાં ધર્મ પુસ્તક રાખીને

**તલવારથી** કુદી પડવાથી છૃદ્દીપણું થઈ શકતા નથી.

**ઉત્કર્ષ સાધ-** આવા ધર્માતરે અંતરના ઉમળકા કેવાનો જમાનો હૃદ્યની લાવના રહીત હોવાથી તેમજ

**આથમી** બુદ્ધિગમ્ય ન હોવાથી લાંખી સુદૃત રકી

**ગયો છે** શકતા નથી તેમજ નેતિક જીવનને તેની

ઉચ્ચ્ય કક્ષાએ હોંચાડી શકતા નથી, તેમજ

વળી કોઈના ખલા ઉપર કે છાતી ઉપર ચડી એસીને કે

શીરનેરાઈથી આ જમાનામાં ધર્મનો ઉત્કર્ષ સાધી શકાય

નહીં. બુદ્ધિગમ્ય દલીલોથી હૃદ્યને જીતીને જ આપણું

મન્તરથી અન્ય કોઈના મન ઉપર ઠસાવી શકાય. જીવો

અને જીવવા ઘો (Live and let live) ના

**વર્તમાન** સુત્રને અનુસરીને સૌ કોઈએ પોતાના

**ચુગમાં કેવા** ધર્મશાસ્ત્રના ચિદ્ધાતો, પર મત સહીપણું

**પ્રકારની** તાની કક્ષાથી આગળ વધીને સમભાવ-

**જરૂર છે** પૂર્વકનીવૃત્તિથી, સાહી અને સરલભાષામાં,

સચોટ અને સંગીન દલીલપૂર્વક, કેવળ

સંપ્રદાય દિલ્લિ ખાનુ ઉપર રાખીને નાની નાની પુસ્તિકાએ છારા પ્રસ્તીદ્ધ કરીને વિના મુલ્યે કે નળવી કોઈમતે છુટે હાથે જનસમાજ સમક્ષ રણુ કરવા જોઈએ અને સમાજને તે સંખ્યમાં ઉડો વિચાર કરતી કરી મુઠવી જોઈએ. ચાર સંજીવીની ન્યાયના ધોરણે અગરતો સાચી અને ખરી વસ્તુને ક્ષેત્રી ઉપર કરી જોઈ સમાજ આપો આપ સાચી વસ્તુ જ અહણુ કરવા ચોણ્ય હશે તે જ અહણુ કરશે અને જીવનના વિકાસકરણમાં આગળ વધવાં જીવનનો આદર્શ અને સાધ્ય વસ્તુનો નિર્ણય કરશે. આવા લોકોપકારક કાર્યમાં કદાચહુ કે સંપ્રદાય દિલ્લિને ચીકટાઈથી વળગતિ ન રહેતાં સમાન ભાવથી કામ દેવાની પદ્ધતિ અંગીકાર કરી ધૃત કાર્યમાં સર્કણતા મળે એ ધોરણે આગળ વધવું જોઈએ. આ વસ્તુને જ ધર્મનો સાચો અને વિશ્વબ્યાપક પ્રચાર અને શાસનનો જવલંત ઉદ્ઘોત કહી શકાય. આવા પ્રચારથી જ વિશ્વપ્રેમ અને વિશ્વાંધૃતવની ભાવનામાં ઓતપ્રોત થાંદેલી શ્રી વીર પરમાત્માની “સવીજીવ કરૂં શાસન રસી”ની ભાવનાને સર્કણ અને સાર્થક કરી શકાય.

ધાર્મિક સાહુિત્યના પ્રકાશન અને પ્રચાર કાર્યમાં અન્ય અનેક સંસ્થાઓના ધીકરા પ્રચાર કાર્યના પ્રદ્તાવો અને અનુભવેને નજર સન્મુખ રાખી ધર્મના ઉદ્ઘોત અને ઉત્કર્ષની સાધના માટે આપણે ધાણું ધાણું કરવાનું રહે છે. ભગવાન ગીતાનો સર્કણ મુકાબલો કરી શકે તેવા જૈન ધર્મના ડેઝ પુસ્તક તરફ એકદમ અંગુલી નિર્દેશ થઈ શકતો નથી. જૈન તેમજ જૈનેતર સાક્ષર વર્ગમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે,

વિચારક ભુદ્ધિમાન વર્ગને સર્વ રીતે સંતોષ આપે અને આકર્ષી શકે, વર્તમાન સમયને સર્વથા અનુકૂળ થઈ પડે તેવું શ્રી મહાવીર લગવાનના જીવન ચરિત્રનું કોઈ અપૂર્વ પુસ્તક, ઐતિહાસીક દસ્તિઓ સર્વ માન્ય થઈ પડે તેવું હજુ આપણે તૈયાર કરાવી શક્યા નથી. આવા પુસ્તક માટે જેઠતી વસ્તુ જુદા જુદા અનેક ધર્માચન્દ્રમાંથી ઉપદ્ધાધ થઈ શકે તેમ છે. પરંતુ તેને એકત્ર અને સંગઠીત કરવા માટે પુરતી કાળજીપૂર્વકની મહેનત લઈ જરૂર જોગી જહેમત ઉડાવી શકે તેવા શાસ્ત્રવિશારદ-વિદ્ધાન અને જીવન-ચરિત્રોના નિષ્ણુત લેખક પાસે યોગ્ય પુરસ્કાર આપીને તે તૈયાર કરાવવું જેઠાં.

શાસ્ત્ર વિશારદ શ્રી વિજયધર્મસ્યરિએ અથાગ પ્રયાસ લેછ પારાવાર જહેમત ઉડાવી, તે સમયમાં સુપ્રસીદ્ધ જૈન વિષમ ગણ્યાતો લાંબો વિહાર કરી ૪૦-૪૫ પંડિતોની વરસ ઉપર ખનારસમાં શ્રી યશોવિજયજી છિપેક્ષા કરી જૈન પાઠશાળાનો સ્થાપના કરેલ ને જૈનેતર શાસ્ત્રી અજોડ અપૂર્વ પાઠશાળાને પણ અધ્યાપી એને પુષ્કળ પર્યાત આપણે નિલાવી શક્યા નથી. અચ્ચેનલાવતો વળી સદર પાઠશાળામાં તૈયાર થયેલ કેટ-જૈન સમાજ લાક જૈન પંડિતોને પણ જૈન સમાજ અપનાવી શકી નથી એટલે તેને જૈનેતર વિશાળ ક્ષેત્રમાં પોતાનું સ્થાન શોધી લેવું પડયું છે અને આપણો સાધુ વર્ગ સમાજના દ્રવ્યના લોાગે અને પુષ્કળ અર્થ કરીને જૈનેતર પંડિતોને નલાંયે જય છે. એકાદ

એ જ સાધુના અલ્યાસ માટે માસીક ખસો વણુસોનો ખર્ચ જરાપણું ખટકતો નથી. કવચીત નામના ખાતર આવા શાસ્ત્રો-ઓને આમાનું આમના વિહારમાં સાથે રાખવામાં આવે છે. આવી પરિસ્થિતિના કારણેની ઉંડી સમીક્ષા કરતાં જણાણી કે ઓક-ધીજા તરફની ઈર્ધા તેને દ્રેષ, અહંકાર આપવડાઈ, અલિમાનવૃત્તિ બગેરે ઊંડા ઊંડા છુપાઈ રહેલા હોય છે.

સાદી-સરલ ભાષામાં લેાક લોએ થઈ પડે તેવી પદ્ધતિથી, પારિસાધીક, ગુઢ રહસ્ય પૂર્ણ અને અર્થ ગાંભીર શાખદોના વિવેચન પૂર્વકના શાખાર્થના ટીપણું સાથે જૈન ધર્મના સીદ્ધાંતો અને તત્ત્વોના ગણન અન્યોના ભાષાંતરે ઘણી સસ્તી કીંમતે હારેનો જૈન-જૈનેતર અલ્યાસીઓ લાલ લદ્ધ શકે તે દિલ્લી પ્રસિદ્ધ કરવાની જરૂર છે. જૈન ધર્મનો ઉદ્ઘોત અને પ્રચાર થાય છે. તેવા ખ્યાલથી, વાહુ વાહુ કહેવાય સસ્તી કીર્તિં ખાટી શકાય એ ગણુતરીએ આંખો મીઠીને આપણે ઉધાપનો ઉત્સવો અને વરદોડાએ પાછળ લાખો રૂપૈયા ધીન લાલ કારક રીતે (unproductively) આપણે ખર્ચે જરૂરે છીએ પરંતુ તરતમનાએ અનેક સ્વીતે લાલહાયક થઈ પડે તે ધોરણે-સાચી દીશામાં ખર્ચ કરવાનું આપણુને સુઅતું જ નથી. શાસ્ત્ર વિશારદ વિદ્યાન ઉપરે શકેનો રોકી તોમની મારકૃત દેશ-પરદેશમાં. હુર હુરના વિલાગોમાં જૈનધર્મનો વિજય વાવટો ઝરકાવી શકાય તેવા સમયનો આપણે પુરેપુરે લાલ ઉડાવી શકયા નથી.

વર્તમાન સમયની અનેક પ્રકારની વૈજ્ઞાનિક શોધોનો પુરેપુરે લાલ લેવા માટે આપણે કટીગઢ થવું જોઈએ.

એડીમોક્ષારા, ધ્વનિવર્ધક ચંત્રોક્ષારા, સીનેમા—ટેક્સીજ તેમજ  
વર્તમાન પત્રો મારફત વિક્રતાપૂર્ણ ભાષણો,  
ગ્રચાર કાર્ય કેખો, નિવેદનો, ગ્રવચનોત્થા ગંભીર  
માટે વૈજ્ઞાનિક રહસ્ય લર્પૂર ઉપરેશાતમક ચિત્ર-પ્રકા-  
શોધાનો લેવો શનો ક્રારા, લગવાન મહાવીરનો સંદેશો  
બેધતો લાભ. લાખો—કરોડા મનુષ્યો સુધી પહેંચાડવાની—  
ધર્મનો ગ્રચાર કરવાની અમુલ્ય તકે, વિપુલ  
સાધનો સાથે અઠેપગે તૈયાર છે. કુશળતા પૂર્વક તે અધી  
તકેનો વધારેમાં વધારે લાભ ઉઠાવી શકાય most pro-  
ductively) તે રીતે વિવેક પૂર્વક ઉપગોગ કરવાતું આપણે  
શીખી લેવું જોઈએ. સંકુચિત વણીક બુદ્ધિ ણાનું ઉપર  
રાખી, પુરતા ઉત્સાહ પ્રેરક અને સંતોષજ્ઞનક વેતનો,  
ખારિલોબિંકો, પુરસ્કારો આપી માનદ સુવર્ણચંદ્રકો આપી  
નિષ્ણુત બંધુઓ પાસે પૂર્વચાર્યકૃત ધર્મઅન્યોના ભાષાંતરો,  
મૌલીક પુસ્તકો, નિષંધો વગેરે તૈયાર કરાવવા માટે છુટે  
હાથે—મોકણે મને ખર્ચ કરવું જોઈએ.

જુદા જુદા હર્ષન શાસ્કોના અભ્યાસીઓ જૈન નૈનતર  
વિક્રાન બંધુઓ તરફથી કેવળ સંપ્રદાય

**મૌલીક દ્વિષિટ ણાનુ** ઉપર રાખી, સમલાવવૃત્તિ  
**વિચાર પુર્વક** અને વિશાળ દ્વિષિથી લખાયેલ પુસ્તકો  
**ઉદ્ઘોધક** નિષંધો—કેખો અનેક રીતે લોકપ્રિય અને  
**પ્રકાશનોથી** આકર્ષક થઈ પડશે અને ધાર્મિક સીદ્ધાંતો  
**થતો અપૂર્વ** અને તત્ત્વજ્ઞાનના વિષયોમાં ઉડો રસ ધરા-  
**લાભ.** વતા જ્ઞાસુ બંધુઓ હારોની સંખ્યામાં

ઉપરોક્ત પ્રકાશનેનો લાલ લેવા તત્પર રહેશે અને તેવો લાલ લેતાર બંધુએ ખનવા જોગ છે કે પ્રકટરીને ધર્માંતર કરવા જૈનધર્મનો સ્વીકાર કરી લેવા કહાય ઝડાર ન પડે છતાં પણ જૈનધર્મના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનના ઉંડા અભ્યાસથી તેઓ તેને માટે અપૂર્વ માન ધરાવતા થઈ, નૈતિક અધઃપતનમાંથી જાણી જઈ જીવનના ઉચ્ચ આદર્શો નજર સન્મુખ રાખી, વિકાસકુમ માટેની આગેકુચોનો જરૂર આરંભ કરશે અને તે આપણા પ્રચારનું જ પરીણામ સમજવું અને તેવો પ્રચાર જ સાચા ઉત્કર્ષ નજીક લઈ જવા સમર્થ થશે.

જૈનધર્મના ઉત્કર્ષ માટેનું ઉપરોક્ત વીવેચન જૈન-સમાજના ઉત્કર્ષ માટે પણ ધાર્ણી રીતે શીક્ષાપ્રદ અને પ્રેરણુદ્દાયી થઈ પડે છે. જૈનસમાજને સંખ્યા ખળમાં વૃદ્ધિ પામતો જેવાની કેટલી ઉલટ અને ઉત્સુકતા છે તેથી પણ વધારે ઉલટ અને ઉત્સુકતા તેને ગુણવત્તામાં આગળ વધતો જેવાની આપણે ધરાવીએ છીએ. કેટલાક સુણ અનુભવી મહા પુરુષોનું કંઈક એવું જ મંત્રબ્ય છે કે વैજ્ઞાનિક શોધો અને સંશોધનોની ખાખતમાં જમાનો આગળ વધતો જય છે પરંતુ નૈતિક વર્તનની ખાખતમાં આપણે કંઈક પાછા પડતા જઈએ છીએ આપણું નૈતિક અધઃપતન થતું જણ્ણાય છે. વैજ્ઞાનિક શોધોના પરીણામે દિન-પ્રતિદિન મોજશોખની વસ્તુઓમાં વૃદ્ધિ થતી જય છે અને લાવવા-લઈજવાના

સાધનોમાં વૃદ્ધિ થતાં ને બધી વસ્તુઓ ફુનિયા ભરના હર-હરના દેશોમાં પણ વીપુલ પ્રચાર પામતી જાય છે.

આ રીતે મોજશોખની અને એશારામની વસ્તુઓનો

પ્રચાર વધતાં જીવન નિર્વાહ માટેની ખાસ

નૈતિક અધઃ- જરૂરી જણુતી વસ્તુઓનું વર્તાવ મોટું પતનના કાર- થતું જાય છે. મોજ-શોખની કેટલીક ખીંચુંણાની અને જરૂરી અને નુકશાન કારક વસ્તુઓને પણ તૈનાં સુધ્યારા આ વર્તુળમાં સ્થાન મળતું જાય છે. એક માટેના ઉપા- ખાળું આવું વર્તુળવધતું જાય અને ખીંચુંણાની મીમાંસા ખાળું આ અસહ્ય મોંઘવારીના સમયમાં ફરેક વસ્તુની કીંમત તેની ટોચે પહોંચી ગયેલ છે ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના મનુષ્યને પોતાનો તેમજ પોતાના કુદુર્ખીજનોનો જીવન નિર્વાહ કઈ રીતે કરવો તે પ્રક્રિયા અનેક પ્રકારની ગુંચવણું અને સુશકે-લીએ ઉલ્લીક કરે છે. આવી મુંઝવણુંમાંથી માર્ગ કાઢવાનું ઘણું વિકટ થઈ પડ્યું છે. સામાન્ય રીતે નોકરી કરતો વર્ગ કે સામાન્ય વ્યાપાર કરતો વર્ગ મળુરવર્ગ કરતાં ઘણું કફ્ફાડી અને ચિંતા જનક ચિથ્યિતિમાં મુકાતો જાય છે અને જીવન નિર્વાહને પહોંચી વળવા માટે આવકના ચાલુ સાધનો પુરા પડતા નથી ત્યારે સામાન્ય મનુષ્યને અનીતિના માર્ગ સરી પડતાં વાર લાગતી નથી એટલે જાણ્યે અનાણ્યે લાયારીથી નતિક અધઃપતનની શરૂઆત થાય છે.

ધર્માધિકારી—માર્ગનુસારીના પાંત્રીસ જુદું પકીનો અન્યસ્થાન ધરાવતો પહેલો ગુણું-ન્યાયસ પજ વિલવ વિસ-

રાઈ જાય છે અને પછીતો મનુષ્ય નીચે અને નીચેજ ગળાડતો જાય છે. દ્રવ્યની જરૂરીયાત અનિવાર્ય રીતે વધતી જતી હોવાથી તે માટેનો લોલ વધતો જાય છે અને ગમે તે માર્ગે તે ઉપાજીન કરવાની તેમાં વધારે કરવાની વૃત્તિજ જમતી જાય છે. સર્વત્ર લાંચ, ડેશવત, કાળાખણર, હંલ પ્રપંચ, દુગલભાળ અને અન્યાય અનીતિના વ્યવસાયો જ વધી પડેલ છે અને તે એટલી હુદ્દ સુધી આવા વ્યવસાયોમાં ગરકાવ થઈ ગયેલો તે રાન્યો માચ્યો રહેતો જણ્યાય છે કે તે પોતાની તક-સાધક શક્તિ અને અનીતિ પૂર્ણ વ્યવહારે ચાલુ રાખવાની બાહેશી માટે અભિમાન અને ગૌરવ લેતો જણ્યાય છે અને પોતાના અચાવમાં કુશળતા પૂર્વક અનેક પ્રકારની ફલીલો આગળ કરે છે. આવું નૈતિક અધ્યાત્મિક પતન સર્વત્ર ચેમેર પ્રસરી ગયેલું હોવાથી તેમાંથી સમાજને કષ્ટ રીતે અચાવી લેવો તેનો પ્રથમ દરજને વિચાર કરવાની જરૂર છે. તેવા અધ્યાત્મમાંથી ઉંચા આંદ્યા પછી જ ઉત્કર્ષ કે અલ્યુદ્ય માટેની વિચારણા શર્ધે સાચા-વિશુદ્ધ-સરલ નિર્દ્દિલી-પ્રમાણીક જીવન વ્યવહારથીજ જીવનનિવર્ધિના સાખનો મેળવવાનો સંતોષ અને સંયમ પૂર્વક જીવનની જરૂરીઆતો એકદમ દુંકાવી નાખવાને, પુણીયા શ્રાવક જેવા અનેક લંઘ જીવેના દૃષ્ટાંતો આગળ કરી નૈતિક જીવનના વિકાસ માટેનો ઉપદેશ જ ઉપદેશક વર્ગ આપવાનું ચાલુ રાખવું જેઠાં વિક્રિયા લેખકોએ પણ તેવા વિષયો જ હાથ ધરવા જેઠાં.

પ્રત્યેક વ્યક્તિએ જીવન સુધારણાનો—ચારિત્ર બંધારણ  
 ( character building ) અને ઘડતરનો  
 ચારિત્ર બંધા- પ્રશ્ન વગર વિલંબે હાથ ધરવો જોઈએ.  
 રણની અનિ- વિવેક પૂર્વક ચારિત્ર બંધારણ અને ઘડ-  
 વાર્ય આવ- તરનો પ્રશ્ન હાથ ધર્યો સિવાય જીવન  
**શ્યકૃતા**      વ્યક્તહારના- કર્યો સરદ બનાવી શકાય  
 નહી તેમજ જીવન નૌકાને, નૈતિક ઉચ્ચ  
 આદર્શ રૂપ મજબૂત સુકાન સિવાય આગળ ધપાવી શકાય  
 નહી ચારિત્ર શીલ વ્યક્તિએ જ ઓજ સામાજિક ઉત્કર્ષ  
 માટે સમાજને અનેક રીતે મદ્દગાર અને ઉપયોગી થઇ  
 પડશે, ચારિત્ર સંપત્ત વ્યક્તિએ સેવાલાવી વૃત્તિથી સામા-  
 જક ઉજ્ઞતિ માટે લેખ ધારણ કરી, નિડરતા પૂર્વક સમાજ  
 સુધારણાના વિધ વિધ કાર્યક્ષેત્રોમાં સંપૂર્ણ ઉત્સાહ અને  
 ઉમંગ લેર અંપદ્ધાવશે. ત્યારે તેમનો પ્રલાવ સમાજ ઉપર  
 કંઈક નવી જ લાત પાડશે અને અભ્યુદયનો અર્દ્ધાદ્ય  
 ક્ષિતિજની દષ્ટ ભર્યાદામાં દષ્ટિગત થશે.

આવા ઉત્સાહી બંધુઓના સેવા મંડળો જૈન વસ્તીના

મોટા મોટા કેન્દ્ર સ્થાનોએ ઉલા કરવામાં  
 સેવા મંડળોના આવે અને તેમની દ્વારા સામુદ્દર્યીક રીતે  
 સહયો માટેના સમાજના ઉત્કર્ષ માટેની તૈયાર કરવામાં  
 સેવા સદનો આવેલ વ્યવસ્થિત ચોજનાએ પાર પાડવા  
 માટે પ્રયાસ કરવામાં આવે તો કાર્ય સિદ્ધ  
 સુગમ થઇ પડે આ સેવા મંડળો તેમના મુખ્ય શહેર અને  
 તેની આસપાસના પ્રદેશો ઉપર ધ્યાન આપશે. આવા સેવા

મંડળોના લેખધારી-આજુવન સભ્યો માટે સેવાસહનોની પણ વ્યવસ્થા કરવી પડ્યો. આવા સેવાસહનોની સ્થાપના અને ચાહું નિબાવ ખર્ચ માટે સમયને અનુસરીને દાન પ્રવાહની દશા બદલાયેથી નાણું મેળવવાનું કાર્ય કંઈક સુવલ થઈ પડ્યો પરંતુ તેની વ્યવસ્થા માટેના કુશળ સેવા-લાવી કાર્યકરી તેમજ જીવનભર સમાજ સેવાની વૃત્તિથી સંપૂર્ણ ધગશ અને તમજા પૂર્વક ઉત્સાહથી કામ કરનારા સમાજ સેવકો-સેવાસહનના આજુવન સભ્યો તરીકે મેળવાનું કાર્ય ધાર્થું જ મુશ્કેલ છે. સામાન્ય રીતે આપણે જૈન સમાજ મોટા ભાગે પોતાના વ્યાપાર ઉદ્ઘોગમાં જ રહ્યો પણ્યો રહે છે. વળી સંકુચીત મનોદશા પૂર્વકની કેવળ સ્વાર્થ નિષ્ઠ વાણીક વૃત્તિની પ્રાધાન્યતા જણાય છે. વિશાળ ભાવના પૂર્વકની-વસુધૈવ કુટુમ્બિકની મનોવૃત્તિવાળી ઉચ્ચ સેવાભાવની વૃત્તિ હજુ આપણું મને એ તેટલા મોટા પ્રમાણમાં જાગૃત થઈ નથી એટલે આપણું સેવા સહનોમાં આ જીવન સભ્યોની ભરતી થતાં કંઈક વિવંખ થાય એ અનવા જેગ છે છતાં પણ તેની સ્થાપના માટે આપણે જરા પણ ઢીલ કરવી જોઈએ નહીં. આ જીવન સભ્યો ઉપરાંત અમુક સમય માટેના (Periodical) સભ્યોની પણ જેગ-વાઈ કરવી કુટુમ્બીજનો-જેમનો આવા સભ્યો ઉપરાજ જીવન નિર્વાહનો આધાર હોય તેવા સજજનો નોકરી કે ધર્યો એકદમ છોડી દઈ આવા સેવાસહનોના સભ્યો બને તો તેમના કુટુમ્બી જનોના જીવન-નિર્વાહ માટે શરૂઆત-થીજ સેવાસહનોના ટ્રેસ્ટી અને પ્રયોજનીકે ચોગ્ય પ્રણંદ્ય

કરી આપવો જોઈએ. સેવાસહનમાં જોડાનાર માટે કંઈક  
ઉદાર નજરે ખોરાકી-પોષાકી વગેરેનો બ્યવસ્થિત પ્રણંધ.  
કરી તેમને દીશા સૂચન માટેની ચોંચ કાર્યવાહી-  
સલાહ-સૂચના પૂર્વકની નિયમાવળી તૈયાર કરવી જોઈએ.  
વળી આવા સેવાસહનોમાં જરૂર પુરતું પુસ્તકાલયનું સાધન  
પણ હોવું જોઈએ કે જેથી સમાજ સેવકો જૈન કુદુર્ભળી  
જનોથી છૂટા થઈ સેવાસહનમાં જોએ ન જોડાઈ શકે તેમને  
જરૂરીયાત મુજબ નિર્વાહ મારેનો ચોંચ પ્રણંધ કરી  
આપી તેમની સેવા વૃત્તિનો, ચોંચ દીશા સૂચન સાથે બને  
તેટલો લાભ લેવા તત્પર રહેવું. આવા

**સેવાલાવી** સેવાલાવી કાર્યકરો અને સ્વયંસેવકોથી  
કાર્યકરો અને બ્યવસ્થા પૂર્વક કામ લેવામાં આવે તો—  
**સ્વયંસેવક** ચોકસ લાઈનદોરી નક્કી કરી તે મુજબ  
બંધુઓનું આગળ ધ્યાવામાં આવે તો સામાજિક  
**વીશાળ** ઉત્કર્ષનું કાર્ય ધરણું સરળ થઈ પડે.  
**કાર્યક્ષેત્ર** આવા સામાજિક ઉત્કર્ષના પરમ કલ્યાણ-  
કારી અને ઉત્તરોઉત્તર લાભદારી કાર્યમાં  
જે કંઈ શક્તિનો અને દ્રોયનો બ્યય થશે તે તરતમતાએ—  
સર્વ રીતે સાર્થક અને ફ્રણદાયી (Productive) જ થઈ  
પડશે. વગી દ્રવ્યના બ્યય કરતાં પણ કેવળ સેવાલાવ અને  
ઉપગાર વૃત્તિથી જ તેમજ ઉદારભાવનાથી સમાજને મોખરે  
આવી ઉત્તેલા બ્યવહાર કુશળ અને જુદા જુદા વિષભના  
નિષ્ણુત (Experis) કાર્યકરો સાચા હૃદયથી પોતાની  
શારીરીક અને માનસીક શક્તિનો જે લોગ આપશે તે

અનેક ગણેં કુળજીથી થઈ પડશે. પક્ષસેહ કે મત-મતાંતરના કારણે, કાળજીના દઘિટકોણુથી, પરંપરાગત રાહ-રશમોને અનુભરી, ઉપરોગપૂર્વકની વીવેકપૂર્ણ દૃષ્ટિ કે સારાસાર વિચારવૃત્તિને તીવ્યાજલી આપી અત્યારે આપણે જે ધોરણે દ્વારા અને શક્તિનો હુદ્દુંથી કરી રહ્યા છીએ તે એકદમ સમાજહીત અને લોક કલ્યાણની દૃષ્ટિએ અટકાવી હેવાની જરૂર છે લોકશાસન તંત્ર પગસર થતું જાય છે—સમાજ-વાહીએ અને સામ્યવાહીએ મુડીવાણી સામે પોતાના અડ્યા જમાવી રહ્યા છે તેવા કાંતિકારી • જમાનામાં ધનપતિએ અને લક્ષ્મીવાનોએ સમજી બેનું જોઈએ કે પોતાની પાસેના સંબંધીત દ્વારા તેઓ ખરી રીતે ટ્રસ્ટી ઓઝ છે અને તે દૃષ્ટિએ તેમાની પાસેના દ્વારા હુદ્દુંથી આધુનિક સમાજ નભાવી હેવા તૈયાર નથી એટલે તેમણે પોતેજ હૃદય પડ્યો કરી, હાન પ્રવાહની દીશા એકદમ બદ્દાં નાંખી ઉત્તરોત્તર સમાજ હીતમાં વૃદ્ધિથાય તે રીતે પોતાના દ્વારા ઉમંગ અને ઉત્તરસેર સામાજિક કાર્યોમાંજ વાપરવાની તત્પરતા દાખલવી જોઈએ અને સેવાભાવી સામાજિક અયેસરેને પુરેપુરે સાથ અને સહકાર આપવા કરી બદ્ધ થતું જોઈએ. આવા સાથ અને સહકારથી જ સેવામંડળો અને સેવાસંદનો સામાજિક ઉત્કર્ષના ભગીરથ કાર્યને આગળ ધપાવી શકશો સેવામંડળોના સાચા સમાજ સેવકો તાલીમ બદ્ધ સ્વયં-સેવકોને-તેમના દળોને અનેક સામાજિક કાર્યોમાં વીવેક પૂર્વકની યોગ્ય હોરવણી આપી શકશે.

હાલના કપરા કાળમાં સમાજનો મોટો ભાગ જીવન  
નિર્વાહના પ્રશ્નોના ઉકેલ માટે અનેક પ્રકા-  
હાલના કપરા કારની સુંયવણો અનુભવી રહ્યો છે, ચારે  
સમયમાં બાળુથી લીંસાઈ રહ્યો છે. જીવનની જરૂ-  
**વિધવિધ પ્રકાર-** રીયાતની વસ્તુએ અજ્ઞ (ખાદ્ય પદાર્થો)  
ના રાહત ત્થા અનેક વસ્તુએ તેમજ વસ્તો જેને  
કાર્યો ચાલુ પૈસો પણ મેળવવાની મુશ્કેલીએ વધી  
કરવાની જરૂર. પડી છે તેવા સમયમાં ઉત્સાહી સ્વયંસેવકો  
મારફત, સ્વામીભાઈઓને તન, મન અને  
ધનથી જેટલી રાહત આપી શકાય તેટલી એઠીજ છે.  
નાના-મોટા તમામ શહેરેમાં જુદાજુદા લતાઓમાં રાહત  
માટેના કેન્દ્રસ્થાને ઉલા કરી નીયમીત રીતે અને વ્યવસ્થા  
પૂર્વીક રાહત કાર્યોનો આરંભ કરી હેવો જરૂરી છે. પ્રાથમીક  
કેળવણીથી માંડીને ઉચ્ચતમ કેળવણી પર્યાત-કેળવણીની  
તમામ જુદાજુદા ક્ષેત્રોમાં તેમજ વૈદકીય મહાં અને સાર-  
વારના સાધનો પુરા પાડવાની બાબતમાં કોઈપણ જતનો  
લેદલાવ સીવાય તમામ જૈન ધંધુઓને-પ્રત્યેક વ્યક્તિની  
વિધવિધ પ્રકારની ખાસ જરૂરી આતોનો અલ્યાસ કરી છુટે  
હીથે રાહતકાર્ય વિના સંકોચે અને વગર વિલંબે શરૂ  
કરી હેવું જોઈએ. સ્કુલો ત્થા કોલેજેની ધીમાં-પુસ્તકો ત્થા  
અન્ય કેળવણીના સાધનોની કીમતમાં એટલો ખંડો વધારે  
થઈ ગયો છે કે સામાન્ય કુદુંઘને પોતાના તમામ બાળક  
બાળકોએને કેળવણી માટેની ચોંચ સગવડ કરી આપવાનું  
તેમજ કુટંખમાં મંદવાડ પ્રસંગે એંચિયી વળવાનું અશક્ય

થઈ પડયું છે અને નિરૂપાયે એટકી જવું પડે છે છેલ્લા પચાસેક વરસોમાં બોડીંગો—ભાગાશ્રમો—વિદ્યાલયો. છાત્રાલયો—ગુરુકુળો—વિદ્યાર્થીગૃહો ટીક ટીક સંખ્યામાં આપણે સ્થાપી શક્યા છીએ છતાં સેકડો જૈન વિદ્યાર્થીઓને તેમના અને તેમના માણાપોને, આવી સંસ્થાઓમાં જગ્યા નહીં મળતી હોવાથી ઉંડી નિરાશા અને લાચારી અનુભવવી પડે છે.

છેલ્લા સવાસો—હોઠસો વરસો ઉપરજ સ્થાપીત થયેલ આર્થસમાને તેમજ અન્ય સમાજોએ હેશ-અન્ય જૈનેતર ભરમાં ઉપરોક્ત સંસ્થાઓ ઉપરાંત એટલી સમાજને મોટી સંખ્યામાં કોલેજો, હાઇસ્કુલો—કન્યા સુકાયદે જૈન મહાવિદ્યાલયો અને ખાસ કન્યાઓ માટેના સમાજની શુરુકુળો સારી આખોહવાવાળા સ્થળોમાં શોચનીય પરિ- ઉલા કરી દીધા છે કે જેના પ્રમાણમાં સ્થિતિ. આપણે કંઈજ કરી શક્યા નથી એમ

વિના સંકોચે કહી શકાય. જૈન જેવી સધન અને માતાપર કોમ અન્ય બાળતોમાં હજારો અને લાખો રૂપેંઓનો ખર્ચ પ્રતિવર્ષ કર્યો જતી હોવા છતાં આવા ઉપરોક્તી અને મહત્વના કાર્યમાં અન્ય લાઈબાંધ કેમેની જાથેની હરિક્ષાઈમાં પાછલી હરેળમાં આવી જાય તે આપણું આગેવાનો મારે ચિંતાનો વિષય ગણુંબો જોઈએ. એહ સાથે કહેવું જોઈએકે આપણું ઉપરેશક વર્ગે બુજ આપવાનું સિલાથ આ વિષયમાં સમાજને સાચે રસ્તે દોરવામાં અશ્વર્ય એદર-કારી અને ઉદાસીનતા જ દાખલ્યા છે. તેમનામાં કંઈક એવોજ પૂર્વભાહ (Prejudice) બંધાઈ જયો છે કે ઈંગ્રેઝ

કેળવણી નાસ્તિકતા તરફ હોય જય છે પરતુ શાંત ચિંતે ઉદાર બૃદ્ધિથી નરી બાળીશતાનો ત્યાગ કરી એકદર રીતે વિચાર કરવામાં આવે તો તેમાં કેળવણીનો લેશમાત્ર હોષ નથી. સંકુચીત મનોવૃત્તિથી કંઈક અકાઇમાં રહુને, કેળવાયેલ વર્ગ તરફ કેવળ ઉપેક્ષા અને એ પરવાઈ અતાવવામાં આંદ્રાથી તે વર્ગના સ્વમાનને કંઈક ક્ષતિ ઘેણંચયાથી તે વર્ગ હરને હર રહ્યાનું જણ્યાય છે. આ અભિતની વધારે ચર્ચા અત્ર અસ્થાને હોઢ એટલું જ કઢેવાનું પ્રાસંગિક જણ્યાય છે કે સાચી કેળવણી કદીપણું અનિષ્ટ રૂપે પરિષુમતી નથી. કેળવાયેલ વર્ગમાં ધાર્મિક સંસ્કારો અને ધર્મ ભાવના માટેની પ્રેરણા ઉદ્ધૂવે, વૃદ્ધિ પામે, તેમની જ્જાસાને સંતોષ મળે તેવા પ્રયત્નો અને પ્રયાસો કરવા ઉદ્ઘર્મવંત ખનવું જોઈએ.

કેળવણી સીવાય કોઈપણ રીતે સમાજ આગળ વધી.

શકે તેમ નથી એટલે જમાનાને અનુસરી વિવિધ પ્રકારની જુદીજુદી તમામ પ્રકારની કેળવણીની વૃદ્ધિ.

કેળવણીને માટે સમાજના આગેવાનોએ તન, મન આપવું જોઈતું અને ધનથી સર્વદા પ્રયત્નશીક્રિ રહેવું

ઉત્તોજન જોઈએ. આપણા સમાજનો મોટો ભાગ

વણીક બંધુઓનો હોવાથી વ્યાપાર ઉદ્ઘોગમાંજ આપણે રોકાયેલા છીએ એટલે જમાનાને

અનુસરી ખાસ કરીને ઔદ્ઘોણીક કેળવણીની સમાજને ઓછી જરૂર નથી. કેળવણીના વિધવિધ ક્ષેત્રોમાં આપણું પણત પડી જવાથી અન્ય ક્ષેત્રોમાં તો આપણું સ્થાન જ

નથી. પરંતુ વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રમાં પણ આજ કાલ આપણે પૂર્વનું સ્થાન ગુમાવતા જઈએ છીએ અને પરિણામે આપણે સહાયોર્ડી અને નોકરી કરવા તરફજ ઘસડાતા જઈએ છીએ. હજુપણ વર્તમાન પરિસ્થિતિ જેની તે દ્વારા ચાલુ રહેવા દઈશું તે ઉજવળ લાવી માટેની આશા છોડી હેવી પડશે. વધતી જતી સહૃદા ખોરીએ કેટલી હદ્દ સુધી આપણું ઉતારી પાડ્યા છે તેનો સવેળા ચોકસ ખ્યાલ કરી લેવાની જરૂર છે.

લીજ લીજ પ્રકારની કેળવણી માટેના રાહત કેન્દ્રો ઉપરાંત, નિર્દિશમી બંધુઓને ચોંચ્ય મદદ આપી ધંધે વજગાડવા માટે તેમજ તેમને લાયકની નોકરી માટે પુરતો પ્રણંધ કરવા ર્થા ધેર ધેર જરૂર પુરતી વૈધકીય રાહત હેઠાંચાડવા માટેના તાત્કાલીક રાહતકેન્દ્રો ઉલા કરવા જોઈએ.

આવા અનેકવિધ રાહત કેન્દ્રો માટે નાણુંની જેટલી જરૂર છે તેથી વિશેષ સાચા હીલથી કામ હરકેાઈ સંસ્થા કરનારાઓની જરૂર છે. પ્રથમ દરંગે ના સંચાલનનું ઉત્સાહસેર-હીંમત પૂર્વક આવા રાહત સારું પરીણામ કાર્યો ઉપાડી લેવામાં આવે—તેને આગળ જણ્ણાતાં મદદ ધ્યાવવામાં આવે અને તેનું કંઈક સારું માટે નાણુંં પરીણામ નીરખવા સમાજ ભાગ્યશાળી મળીજ રહેછે. થાય તો માતણર નૈન સમુદ્ધાયમાંથી નાણુંં તો આપણુંને જરૂર મળી રહેશે. શ્રી મહાવીર વિદ્યાલય જેવી ધીકતી અને અનેડ સંસ્થાની કાર્યવાહીનો ણરાણર અભ્યાસ કરતાં તેમજ બીજ ધણી

આખતોના અનુભવથી ઉપરોક્ત આશાવાહી નિર્ણયને દરેક રીતે ટેકો મળે છે.

પ્રાથમીક જરૂરીયાત અને અનિવાર્ય આવશ્યકતા ચારિત્રશીલ-સેવાલાવી કાર્ય કરનારાઓનીજ છે અને ચાલુ જમાનાનો તાશીર જોતાં આવા કાર્ય કરનારાઓ મેળવવામાં પણ આપણુંને સુરીબત પડશે નહિ એટંબે હવે સમાજના આગેવાનોએ સાચી સેવાલાવી વૃત્તિથી કેડ બાંધીને બહાર પડવાની જરૂર છે. અન્ય કોઈની રાહ જોવાનો વખત ન શુમાવતાં બને તેટલા લાઇઓનો સાથ અને સહકાર સાધો વગર વિલંબે સમાજના ઉત્કર્ષ માટેના કાર્યોના આરંભ કરી દેવાની જરૂર છે. આવો આરંભ જુદા જુદા ચિલાગોના ડેન્ડ સ્થાનોમાં સેવામંડળો અને સેવાસંનોની સ્થાપના-થીજ કરી શકાય. તે માટેની ચોજનાઓ વિચારશીલ બાંધુ-ઓ સાથે વિચાર-વિનિમય અને ઉહાપોહ કરીને જ ઘડી શકાય. આ પ્રકારની કાર્ય પ્રણાલીકાદ્વારા સમાજની-ચતુર્વિધ સંઘની-સ્વામી લાઇઓની જે કંઈ સેવા કરી શકશે તેજ સાચું સ્વામીવાત્સલ્ય અને વિશ્વાંધુત્વની લાવનાને આગળ ધ્યાવવા માટેનું જેલું પગથીયું, માન કે કીર્તિનો ભુખને સંતોષવા ખાતર પરંપરાગત રૂઢી બળના ઠેણુમાં ધસડાઈ જઈ આપણે હજારો રૂપયાનો ખર્ચ કરી એકાદ ટંક સ્વામી લાઇઓને મિષ્ટાન્ જમાડી સંકુચીત અર્થમાં તે સ્વામીવાત્સલ્ય કરવાનો હાવો લઈએ છીએ તેના કરતાં ઉપરોક્ત સ્વામીવાત્સલ્ય અનેક ગણેા લાલદાયી અને ફૂણાઈ થઈ પડે તેમ છે.

હાલમાં રાજ્ય સત્તાના કાયદાના પ્રતાપે તેવા સંધુ  
જમણો અટકી ગયા છે તેનો લાલ લઈ, કાયદાથી છુટ  
થતાં પણ આપણે સમજુને એવો નિર્ણય શા માટે ન  
કરવો કે હવે પણી તેવા જમણોમાં તેમજ ખીલુ કેટલીક  
૩૬ બાખતોમાં થતું ખર્ચ સેવા મંડળો અને સેવાસહનોના  
સંચાલન પાછળ ખર્ચવું. નવચુગનો જમાનો આવા તો  
કેટલાય જરી પુરાણાં રીત-રીવાળોમાં ઘરમુળનો ફેરફાર  
માગી રહેલ છે તે સીવાય સમાજનો સાચો ઉદ્ધાર અશક્ય  
છે. નવચુગના થનગનતા યુવકોને સમાજના નાયકોએ હીમત.  
અને નિડરતા પૂર્વક સીધા અને સાચા માર્ગજ દોરવાના  
રહે છે. સ્વયંસેવકોને જરૂરી તમામ સ્કુચનાઓ સાથે  
ચોણ્ય માર્ગદર્શિન આપી રાહત કાર્યોનો આરંભ કરી દેવો  
નોઈએ તેમજ તેમને રચનાત્મક કાર્ય કરું કરું કરું કરું  
દેવા નોઈએ સૌ કાર્યકર્તાઓએ વિચારોની આપ-કે માટે  
તેમજ એક-ખીલના અનુભવનો લાલ લેવા માટે અવાર-  
નવાર મળતા રહી લવિષયના કાર્યકર્મ માટેની ચોકસ લાઇન.  
દોરી અને ચોણનાઓ તૈયાર કરતા રહેવું નોઈએ સેવાની  
ભાવના અને ત્યાગ વૃત્તિની ખીલવણી માટે રાત હિન કેશિષ  
કરતા રહેવું નોઈએ.

રાષ્ટ્રીય સરકારના રાજ્ય વહીવટ દરમીયાન જુદા જુદા  
તમામ ખાતાઓમાં સરકારી ઉંચામાં ઉંચા  
ઉત્કર્ષ માટે દરજનાની નોકરીએ માટેના દરવાલ હવે  
અનુકૂળતા ખુલ્લા થઈ ગયા છે. હવે વર્ષ-ધર્મ-જ્ઞાતિ,  
પૂર્ણ વાતાવરણ કે ચામડીના લેદો ફર થતાં હરકોઈ પ્રકા

તેનો લેવો જોઈ માન્ય દેશ બંધુ કે ખણેન ગવર્નર-જનરલ  
તો લાલ ના સ્થાન ઉપર આવી શકે છે. કરોડાની

થાપણું ધરાવતી મોટી મોટી લીમીટેડ  
કંપનીઓ, એન્ડો કે મીલોના મેનેજિંગ ડિરેક્ટરો કે મેન-  
જરો તરીકે ચુરોપીયનોના સ્થાને હાઇકોર્ટના ચોફિનો કે  
પ્રાંતિક ગવર્નરો કરતાં પણ વધારે પગાર વાળી જગ્યાઓ  
ઉપર દેશ બંધુઓને નિયુક્ત કરવામાં આવે છે. શક્તિશાળી  
ખાંડાશ મનુષ્ય નીસરહુના છેલ્લા પગથીયે આરૂધ થઈ  
શકે છે. લાઘોની કમાણી કરી શકાય તેવા અનેક પ્રકારના  
ઉદ્યોગો. અને ઉદ્યોગોની ખાણતોમાં પરહેઠી પ્રણાયોની મોનો-  
પોલી રહ થઈ છે નાની-મોટી નોકરીઓની ખાણતોમાં  
ભાઈ-ભાત્રીન કે મામા-મસીયાઈ સગા સંખ્યાઓ તરફનો  
પક્ષપાત (Nepotism) નઈ થતાં ખુદ્દિ શક્તિ,  
પ્રમાણીકતા, લોક પ્રિયતા-સેવાભાવ વગેરે સહિતુના મુલ્યાંકિત  
થવા લાગ્યા છે. રત્નો અને હીરા-માણુકની પરીક્ષા કરનારા  
ખાંડાશ જવેરીઓ, નિપુણ મુત્સહીઓ અને જણરજસ્ત તંત્ર-  
વાહુકો અને માનનીય પ્રણ સેવકોના હાથમાં દેશ-ભરના  
શાસન તંત્રની લગામ સુપ્રત કરવામાં આવી છે. પરહેશો  
સાથેના સંખ્યાઓ આંતર રાષ્ટ્રીય વ્યવહારો (International  
relations) ઉચ્ચ કક્ષામાં મુક્તા જાય છે. આપણા દેશ  
બંધુઓ માટે પરહેશોના કાર ખુલ્લા થતાં જાય છે-ભારત-  
વર્ષીય પ્રણાયનો ઉપરની અટકાયતો હુર થતી જાય છે.  
પરહેશોમાં જઈને વસેલા આપણા દેશ બાંધવોના હક-અધિ-  
કારના રક્ષણ માટે તેમજ તેમના તરફના સહભાવ લર્યા

વર्तन मાટે આપણું દેશના રાજ્યતંત્રનાં ધુરા વાહુકો તન-  
તોડ પ્રયાસ કરી રહ્યા છે.

આગામી અને સ્વરાજ્ય પ્રાસ થતાં-ઉપર જણાવ્યા  
મુજબ-દેશભરમાં દરેક ખાળુનું વાતાવરણ અનુકૂળતા અને  
સગવડ ભયું થઈ પડયું છે તેનો ધર્મ અને સમાજના  
ઉત્કર્ષ માટે એને તેટલો લાલ લેવામાં આપણે યત્કિંચિત  
પણ એદરકાર અને પ્રમાદથરસ્ત રહીશું તો અવિષ્યની પ્રણ  
આપણું ઉપર પ્રીટકાર વરસાવશો.

સથાન આપણે પ્રાથમીક ડેળવણીથી માંડીને તે ઊચ-  
તમ ડેળવણી સુધીના તેમજ તેના જુદા  
આપણે સ્વતંત્ર જુદા પ્રત્યેક અંગો-જેવાકે વૈદકીય-ઔદ્ઘો-  
પણ સાવંજ- ગીક-એન્જનીયરીંગ- એથ્રોકલચરલ સાઇન્સ-  
નીક હાઈસ્કુલો ટેકનીકલ-ઇલેક્ટ્રીક, મીલીટરી-પોલોસ-  
અને ક્રોલેજેની એકાઉન્ટન્સી, પત્રકારીત્વ વગેરે-અનેક  
સ્થાપના ઉપ- ભીજી ભીજી વીષયોની ઉંચ્યતમ ડેળવણીના  
રાંત પરદેશ અભ્યાસ માટેની તમામ પ્રકારની અનુકૂળતા-  
જીતાં વિદ્યાર્થી- અને સગવડ-ઉત્સાહી વિદ્યાર્થી એંધુએ  
ઓને ફ્રી લોન- ત્થા ઝેનોને ફ્રી સ્કોલરશીપો યાતો છેવટ  
સ્કોલરશીપો લોન (ધીરાણ પટે જોઈતી નાણુંની મદ્દ) આપવાની ગોડ આપીને કરી આપવી જોઈએ. આ માટે  
વણું કરવી એક વગદાર પ્રથ્મધકારીણું કમીટી, સેવા  
જોઈએ. મંડળના ભાઈઓમાંથી ચોગ્ય પસંદગી  
કરીને નીમવી. મોટા મોટા શહેરોમાં  
આપણું સ્વતંત્ર હાઈસ્કુલો અને મુંખી-અમદાવાદ જેવા

કેન્દ્ર સ્થાનોમાં હાઈસ્કુલ ઉપરાંત-જુદા જુદા વિષયોની-સાર્વજનીક ડોકેન્ચે પણ સ્થાપવી અને તેમાં જૈનતર ભાઈ-ઓને પણ દાખલ કરવા. આ પ્રકારની આપણી સંસ્થાઓમાં આપણે ફરજીયાત તેમજ એચ્યુકી ધાર્મિક કેળવણી માટેનો ચોણ્ય પ્રબંધ કરી ધાર્મિક ઉદ્ઘોત અને પ્રચાર માટે ધણું ધણું કરી શકીએ. હાલમાં ચાલતી કેટલીક ખાનગી હાઈસ્કુલો તરફ નજર કરીએ તો જણાશે કે તેઓ પોતાના જ પગ-પર ઉલા રહેવા ઉપરાંત તેના માલીકોને ધણી સારી કમાણી કરી આપે છે એટલે હાઈસ્કુલ માટે તો નાણ્યાની જરૂરી-આત ખાણતમાં બહુ વિચાર કરવાનો રહે નહિ અને તેથી કોલેજે માટે જ જોઈતા નાણ્યા મેળવી લેવાના રહે.

ડોકેન્ચે માટે તેમજ બીજી ખાણતો માટે જોઈતા નાણ્યા માટેની ચોજનાની ચર્ચા આગળ કરવામાં આવશે તે જે અમલમાં સુકી શકાય તો નાણ્યા મેળવવાની ચીંતા પણ રહે નહિ.

ઉપર જણાવ્યા મુજબ દેશમાંજ રહીને તમામ પ્રકારની કેળવણીનો લાભ લેતા વિદ્યાર્થી બંધુઓને ચોણ્ય રાહત આપવા ઉપરાંત જુદાજુદા વિષયોમાં જ જવલાંત અને ઝણ-કરી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓને ખાસ પસંદ કરીને તેમજ આગળ અલ્યાસ માટે સખળ ઢાંચા ધરાવતાં સામાન્ય વિદ્યાર્થીઓને પણ જુદાજુદા વિષયોના ખાસ અલ્યાસ માટે ઇંગ્લાંડ-અમેરિકા-જર્મની-જપાન-રષીયા જેવા પરદેશોમાં લોન દ્વારા નાણ્યાની પુરતી સગવડ કરી

આપીને અગરતો ક્રી સ્કેલવરશીએ આપી મોકલવા. તેમની પાછળ ખર્ચયેલ નાણુંનો બદલો. તેઓનું ભીજીભીજ વિષ-ચેના નિષ્ણાત બની પરદેશથી પાછા આવીને પુરેપુરા ચેંચ સમયમાં વાળી આપશે; એટલું જ નહી પણ તેઓ સમાજને અનેક રીતે મહદુગાર અને ઉપયોગી થઈ મડશે અને લવિષ્યમાં આપણે ઉત્તરોત્તર આવા પરદેશ જતા વિધાર્થીઓની સંખ્યામાં વધારે કરી શકીશું તેમજ આગળ જતાં નાણું મેળવવાની આપણી ચિંતા ઘણી ઓછી થઈ જશે. આ પ્રશ્ન એટલો બધો મહત્વનો—ઉપયોગી—ઉત્તરોત્તર લાલકારક છે કે તેને હાથ ધરવામાં—આગળ ધરાવવામાં આપણે જરાપણ વિલંબ કરવો જોઈએ નહિ. આ ચોજનાથી પ્રતિવર્ષ શ્રેષ્ઠીબદ્ધ નિષ્ણાતો ભીજીભીજ વિષયોના વિશારદ્દોની હારમાળા ઉલ્લો કરી શકાશે.

લેખ વધારે લાંબો થઈ જવાની બીકે આ પ્રમની વધારે ચર્ચા કરવાનું ઉચ્ચીત જણ્ણાતું નથી. ખાસ નવચુગના જમાનામાં તેની વધારે ચર્ચાની જરૂર પણ જણ્ણાતી નથી. આ પ્રશ્ન તાખડતોણ હાથ ધરવાથી સમાજનો ઉત્કર્ષ કેટલો અડપી વેગ ધારણ કરશે.—સમાજને તેથી કેટ કેટલા લાલોની પરંપરા સાંપડશે તે સૌકાર્ય સહેલાઈથી સમજ શકે તેમ છે.

આ તખડકે આપણે બંગાળ અને ગિહારમાં વસતા આપણા સરાક-જાતિના હઙ્ગેરો ધર્મણંધુ-સરાક જાતિનું ઓના ઉદ્ધાર માટેની પણ વિચારણા કરી ઉદ્ધાર કાર્ય લેવી જોઈએ સરાક ભાઈઓને આપણા જૈન સમાજમાં ચોગ્ય સ્થાન આપી તેમને તઢન-

પશ્ચાત દશામાં હુઃખદ સ્થિતિમાંથી ઉગારી લેવા અને તેમને આગળ વધવા માટેની દરેક પ્રકારની અનુકૂળતાઓ કરી આપવી તે આપણી મુખ્ય ફરજ થઈ પડે છે. સેવા મંડળો એ પોતાના સેવાલાવી ઉત્સાહી સહયોગે તમામ આધનો સાથે તેમના પ્રદેશમાં મેાંકલી તેમના ઉદ્ધાર માટેનું કાર્ય તાત્કાલીક હાથ ધરવું જોઈએ.

આજાદી અને સ્વતંત્રાની પ્રાર્થિની સાથે નાથેજ દેશના ભાગલા પડતાં-આપણા કેટલાક નેન બંધુઓ પાકીસ્તાન પાકીસ્તાન ના પ્રદેશમાં મુકાઈ ગયા છે વિભાગમાં અને તે સાથે તેમની સ્થાવર-જગત ફેસાઈ ગયેલા મીલકત તેમજ આપણા દેવમંદીરો-ઉપા-જીન બંધુઓને શ્રેષ્ઠ વગેરે પણ પાકીસ્તાનના પ્રદેશમાં તાત્કાલીક ફેસાઈ ગયા છે. તે બધાના રક્ષણ માટે મદ્દ આપણે યોગ્ય પ્રબંધ વગર વિલંબે કરવો જોઈએ. પાકીસ્તાન પ્રદેશમાં રહી આસા-નીથી પોતાનો ધર્ઘો-રોજગાર ચલાવવાનું, પોતાનું તેમજ પોતાની સ્ત્રીએ અને બાળકો ત્થા માલ મીલકતોનું રક્ષણ કરવાનું તદ્દન અશક્ય લાગતું હોય અને તે કારણે હીઅરત માટેની વિચારણા કરી રહ્યા હોય તેમને આપણે દરેક પ્રકારની સહાય અને મદ્દ આપવી જોઈએ અને પાકીસ્તાનમાં જ જેએ રહી જવા માગતા હોય તેમના ઉપર ડેઈપણું પ્રકાર નો જુલમ ગુણરવામાં ન આવે તે માટે ત્યાંના સતાધીશો ઉપર યોગ્ય હ્યાણું લાવવું જોઈએ.

વાગી તાજેતરમાં જ ઉપસ્થિત થયેલ શ્રી કેશરીયાજુ  
 તીર્થના પ્રકરણુ સંબંધમાં તેમજ અન્ય  
**તીર્થ રક્ષક** તીર્થને લગતા આપણું પરાપૂર્વના હકુ—  
**કમોટીની** સત્તા અને અધિકાર ઉપર થતાં આડમણુનો  
**સ્થાપના** સામનો કરવા માટે આપણે સામુહારીક  
 ખળનું સંગૃહુન કરી હીમતલેર લડલ  
 એવા જેરથોરથી ઉપાડી લેવી જોઈએ કે નેથી આડમણું  
 કારી રાજ્યસત્તાને પણ નમતું આપવું પડે અને શુદ્ધ  
 ન્યાય તોળવાની ફરજ પડે. ભારતવર્ષના સમસ્ત જૈન  
 સંધનું પ્રતિનિધિત્વ ધરાવતી શેડ આણુંદજુ કલ્યાણુંની  
 ચેઢીએ અને શ્રીમતી જૈનકેન્ફરન્સે કાયમી તીર્થ રક્ષક  
 કમોટીની સ્થાપના કરવી જોઈએ.

આપણે આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ  
 આની જરૂર છે અને તેની જરૂર છે—સેવા મંડળો અને સેવા  
 સદ્ધનો ઉભા કરવા જોઈએ—સેવાલાવી આગેવાનોએ હડાર  
 પડવું જોઈએ—વગેરે વગેરે અનેક અનુસંગીક બાબતોનૌ  
 લંબાણુથી ચર્ચા કરી પરન્તુ તે બધા કામ હાર પાડવા માટે  
 લાખો રૂપૈયાની જરૂર પડશે તે કર્ય રીતે મેળવવા તેનો  
 ખાસ વિચાર કરવાની જરૂર છે. પુરતી આર્થિક મદદ માટેની  
 વ્યવસ્થિત ચોજના સીવાય એક ડગલું પણ કારી શકાયે  
 તેમ નથો. હરેક બાબતમાં ડગલે ને પગલે નાણુનો  
 પહેલી જરૂર છે

પરા પૂર્વથી ચાલ્યા આવતા રૂટ રીત-રીવાનો અને  
 રાહ-રશમોમાં ધરમુળના ફેરફારો કરી આપણે કેટલીક

રકમ ખચાવી શકીએ, વળી હાન પ્રવાહનો દીશા ખફલાતાં ધનિક દાનેશ્વરી અહસ્થો પાસેથી આપણે હાથ ધરવા માગતા મહાભારત કાર્યોની મહત્વતા-ઉપરોગિતા તેમજ તાત્કાલીક ઝળદાયીતા સમજાવી મોટી રકમોના હાન પણ મેળવી શકીએ તથા લગ્ન સમારંભ જેવા ખુશાલીના પ્રશ્ંસે નાની-મોટી રકમો ઝરણ્યાત જુદ્દી કાઢવાની પ્રથા સમજમાં ચાહુ કરાવી કંઈક સારી રકમ ઉભી કરી શકીએ પરંતુ તેટલાથી આપણી ઓળી ભરાય તેમ નથી જ. શરૂઆતથી તમામ દિશામાં આપણું કામ વ્યવસ્થીત રીતે ચાહુ કરી છેવાની તમજા ધરાવતા હોઈએ તો તે માટે આપણુંને વાખો ઝૈયાની જરૂર પડે તેમ છે તે કંઈક રીતે મેળવવા. ?

આપણા લાખો ઝૈયાના ધર્મદાદ ઝડ્ઠોના વહીવટ તરફ નજર કરીએ તો આપણુંને સ્પષ્ટ જણાય દાખોના ધર્મદાદ કે કે તેવા ઝડ્ઠોના મોટા ભાગની રકમો ઝડ્ઠોનો પાપ સરકારી દોનોમાં સ્થુનીસીપદ દોનોમાં ચુંબક કાર્યોમાં બેન્કોમાં તેમજ ચુંબક પ્રસંગે ઉભી કરવામાં થતો ઉપરોગ આવેલી દોનો અને બીજી અનેક સંસ્થા-અને તેમાંથી ઓમાં રોકવામાં આવેલી હોય છે. અને તે અચચા માટે બધા નાણુનો ઉપરોગ દાર્ઢોળો કે શરૂ લે ઝડ્ઠોમાંથી સરંબામ ખરીદવા પાછળ તેમજ બીજા સેવામંડળોને અનેક પ્રકારના આરંભ-સમારંભના પાપ-અપાવી મૂલક કાર્યોમાં કરવામાં આવ્યાનું સ્પષ્ટરીતે બોઇતી દોન. જણાય છે અને જૈન ધર્મશાસ્ત્રના ઝરમાન મુજબ મન, વચન અને કાયાથી કરીને કરા-

चીને કે અનુમોદન કરીને પાપ કે પુણ્ય કર્મનો બંધ થતો હોવાથી આવા ધર્મકા ઇંડિના માલીકો અને વહીવટ કરનારાઓ ઉપર જણુંયા મુજબ પાપ કાયોના મુખ્ય ભાગીદાર થાય છે તેની ડેઇલીની ના પાડી શકાય તેમ નથી. વળી ધર્મદા ઇંડિની મીલકતમાંથી ધીરવામાં આવતી રહ્યો કુલચીતું જોટી થાય છે એટલે પાછી મેળવી શકાતી નથી. એડાઠોર-પાંજરાપોળ કે સાધારણું ખાતે ઘણી જગ્યાએ આવક કરતાં ખર્ચ ઘણું વધારે પડતું હોવાથાં તે તે ખાતાએ હેવદ્રોયો કે તેવા બીજી સંદર્ભ ખાતાએના હારે રૂપચાના હેવાદીના બની જય છે અને લાંબે ગાળે આ હેવું લરપાઈ કરવાનું અશક્ય બની જય છે. કહેવાતા હેવદ્રોય, શાનદાર્ય વગેરે સંદર્ભ ખાતાએના હારે રૂપચાના ન લેવાતા દરદાળીના અને કીમતી અવેરાતમાં તેમજ બીજી જણુસોમાં તથા રોકડ રકમમાં નિર્ધિક વજાર વ્યાજવા પડ્યા રહે છે અને તેના સંરક્ષણ માટે આપણે લયા-આરબો અને પઠાણુને મેટા ખર્ચ રોકવા પડે છે. વહીવટદારો કુલચિતું તેનો અંગત ઉપયોગ કરે છે. હેવું લરપાઈ કરવા તેઓ અશક્ત જણુાતા લેણું ખોડું થાય છે. આવા ધર્મદા (religious and charitable) ઇંડિના નાણુની વ્યવસ્થા બાધતમાં અનેક પ્રકારના ઉંડી વિચારણામાં લેવા ચોંગ કીર્સસાએ આગળ કરી શકાય. તાજેતરમાં જ શ્રી કેશરીયાજી તીર્થના લંડારમાંથી રૂપૈયા પંદર લાખની મનસ્વી રીતે ઉદ્દેપુરના મહારાણાએ વ્યવસ્થા કરવા ધાર્યાનું આપણું જાણુવામાં આવ્યું છે. આવા નાણું માટે લુંટ-ચોરી કે

જિચાપતનો લય પણ માથે લટકતી તરવારની જેમ જુઝતો હોય છે. મોટા મોટા તીર્થોની કે મુંખથી અમદાવાદ જેવા શહેરોના દેરાસરોનો વહીવટ કરતી પેઢીઓના હુસ્તઙ્ના વહીવટ નીચે જુદાજુદા ખાતાના ધર્માદા કુંડોના લંડોળોનો એકંદર સરવાળો તો કરેડો અને અણને સુધી પહોંચે તેમ જણાય છે. આ બધું સુવ્યવસ્થીતરીતે અને અખંડપણે જળવાઈ રહે અને તેની વ્યવસ્થા કરતાં કોઈપણ પ્રકારના પાપધનમાં ઇસાઈ જવું ન પડે અને દેવ દ્રોય સુરક્ષીત રહે એ પ્રત્યેક સાચા જૈનની લાવના હૃદ્યપૂર્વકની હોવી જેઠાએ. એ આસ મુદ્દાની અને કૃષ્ણ વસ્તુ છે. દેવદ્રોયના સંરક્ષણ અને સહઉપયોગનો પ્રક્રસ્તાત્રાહી અને અનેક દેશીય નજરથી ઉડી વિચારણા માગી રહેલ છે.

ઉપરોક્ત મુદ્દાની અને કૃષ્ણ વસ્તુને બરાણર જ્યાલમાં રાખીને જ વિનાનું લાવે સુચન કરવાનું કે ધર્માદા કુંડોના નાણુની સંપૂર્ણ સહીસલામતી માટેની પુરતી જોગવાઈ રાખીને આવા લંડોળોમાંથી બેંકોના વ્યાજના દરે જરૂર પુરતી લોન લેવાની વ્યવસ્થા સેવામંડળોના મુખ્ય આગે-વાને બનતી તજવીજથી અને બનતી તાકીદે કરી શકે તો ધર્મ અને સમાજના ઉત્કર્ષનું કાર્ય ધાર્ય સરલ અને સુતર થઈ પડે. પ્રથમ દરજને આવા મોટા મોટા લંડોળોના દ્રોષીઓને સેવા મંડળોના અથ ગાણ્ય સસ્યો બનાવવા જોઈએ. વળી આ રીતે લોનથી મેળવેલા નાણુનો ઉપયોગ ખાસ કરીને દેશમાં રહીને ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરતા તેમજ પરદેશ જવા માગતા વિદ્યાર્થીઓને લોન સ્કેલરરશીપો

આપવામાં તથા નિર્દ્યમી બંધુઓને ધંધે વળગાડવા માટે જરૂર પુરતી લોન આપવામાં તથા સુરક્ષીત હેખરેખ નીચે સસ્તા લાડાની ચાલીએ. ઉલ્લી કરવામાં તેમજ ચોગ્ય વિચારણાપૂર્વક બીજી જે કંઈક ખાળતો નકી કરવામાં આવે તેવા કામમાંજ થવો જોઈએ. જેમને લોન આપવામાં આવે તેમની પાસેથી લેખીત ફસ્તાવેજ કરાવી લેવાનું તથા તેમના ખર્ચે તેમનો વીમો ઉત્તરવી પોતીસી સેવા મંડળના કળજલમાં રાખવાનું ધોરણું રાખવું તેમજ લોનની વસુલાત માટે ચોગ્ય પ્રણંધ કરવો. ૧ માર્દા ઇંડોના નાણાં સેવા મંડળો મારકૃત આ રીતે લોનથી ધીરવામાં આવશે તે વસુલ આપવા માટે તેવી લોન લેનારતો શું બલ્કે તેની સાત પેઢી સુધીના વારસો આપણા જૈન સંઘના સામાન્ય વહીવટ મુજણ જવાખાર રહેશો. આવી લોનેા કર્મે કર્મે વસુલ થતાં અન્ય બંધુઓને પાછી તે આપી શકાશે અને ઉત્તરોત્તર તેનો લાલ લેનારાઓની વૃદ્ધિ થતી જશે વળી આવી લોન મેળવનારાઓ—તેના પ્રતાપે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતાં લોનના નાણા પુરેપુરા વસુલ આપવા ઉપરાંત સમાજ તરફ—તેના સેવા મંડળો તરફ અવારનવાર પોતાનો ઉદાર હાથ જરૂર લંબાવતા રહેશો. આવી લોન—સ્કોલરશીપોની ચોજનાની ચોક્સ સફુળતાનો પુરાવો શ્રી મહાલીર જૈન વિધાલયના વાખીક રીપોર્ટથી મળી રહે છે. મગના ટગલામાંથી કોઈ કરડુનીકણે તો તેની પરવા કરવી નહીં.

આગળ જણાવી ગયા છીએકે નાણા મેળવવાની મુશ્કેલી કરતાં સાચા કાર્યકર્તાઓ મેળવવાની સુશીલત વધારે મોટી

છે છાં પણ optimistic દિશાએ સહેતુક આશા રાખીએ  
કે ૫૦૩, ક્ષેત્ર, કાગ, લાવ ખાસ કરીને કાળખળ વા ખાણ-  
તમાં આપણને જરૂર મહદુદ્દ કરશો. સેવા મંડળો અને સેવા  
સદ્ગનોની ચોજનાને જેટલી ઝડપથી જેટલી વિશાળતાથી  
જેટલા સદ્ગભાવથી આપણે અપનાવીશું. આગળ ધ્યાવીશું  
તેટલો સમાજનો ઉત્કર્ષ જઈએ સાધી શકાશો અને તેટલા  
પ્રમાણુમાં સમાજ સંખ્યાખળમાં તેમજ ગુણવત્તામાં અને  
અનેક પ્રકારનો શક્તિઓની ખીલવણી અને વૃદ્ધિમાં આગળ  
વધશો. વળી આવી સર્વર્થ અને શક્તિશાળી સમાજ આત્મ  
સંરક્ષણના તેમજ તીર્થી અને ધર્મસ્થળોના સંરક્ષણના  
કાર્યમાં વિષેશ સણળ જનશે. દેવરદ્યનું મહત્વનું વિશેષણ  
જનસ્વયષ્ણ લુંઠુંકરં— સાર્થક થશે. જૈન ધર્મનો સર્વત્ર  
અપૂર્વ ઉદ્ઘોત થશે અને જૈન શાસન જ્યવંતુ જનશે. શ્રી વીર  
પરમાત્માના સાચ્ચા વારસદાર તરીકેના આપણું ગૌરવમાં  
આણુધારી અકલ્ય વૃદ્ધિ થશે. અન્ય લાઈણંધ કેામો  
સાથેની આગે કુચ માટેની આપણી હરીક્રાઈ હીપી નાકળશે.

નબહં કામયે રાજ્યં ન સ્વર્ગં ન પુનર્મ્બંધમ् । કામયે દુઃख  
તસાના પ્રાણિનામાર્તિ નાશનમ् શલૌકાધેર્ન્ પ્રવશ્યામિયદુકતં  
અન્થ કોટિભિः । પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનં ॥  
અહિંસા સત્યમસ્તેર્યમકામ કોષ લોભતા । ભૂતપ્રિયહિતે  
હાચ ધર્મોડર્ણ સાર્વવર્ણિકઃ ॥

ઉપરોક્ત અમૂલ્ય સુત્રોને મુદ્રાલેખ સમાગળી—જીવનના  
મુખ્ય આદર્શ તરીકે નજર સંમુખ રાખી  
સેવા મંડળોના સમાજના અચેસર-બ ધુચોચે વા કપરા

કાર્ય કરો માટે કાર્યમાં અનેક પ્રકારની યાતનાઓ અને  
સુદ્રાલેખ સમાં હુઃખોથી તપી રહેલ સ્વામિ ભાઈઓની  
અસુધ્ય મુત્રો યાતનાઓ અને હુઃખોનો નાશ કરવા માટે,  
પરોપકાર કરવા તેમજ સર્વ પ્રાણીઓનું  
પ્રિય અને હીત કરવા માટેની તીવ્ર કૃચ્છા રાખી પોતાના  
કાર્ય પ્રદેશમાં આગળ અને આગળ જ ધોયા જવું જોઈએ  
તે સિવાય સમાજનો ઉત્કર્ષ અશક્ય જ છે.

સમસ્ત ભારતવર્ષના ભાઈ-જણોની ગાથે મળીને  
કરવામાં આવેલ સાઠ-સાઠ વરસોનો ઉત્ત્રતપશ્ચિમ્ય, પ્રખર  
આત્મલોગ, વિરવ ત્યાગ અપૂર્વ બદ્ધીદાન અને પારાવાર  
કષ્ટ અને યાતના સહનના પરીણામે સ્વરાન્ય પ્રાપ્તિ પછી  
હવે આપણે સામાજિક ઉત્કર્ષ માટે સપૂર્જ જાથીતે પૂર્વક  
સૌ કોઈએ કટીએ થવું જ જોઈએ અને સામાજિક  
સર્વાંગી વિકાસ માટે સર્વ દિશામાં અતુલ પ્રયાસ અને  
અધાર ઉઘમ કરવાનો આરંભ કરી હેવા જોઈએ.

શૈતાભાર મૂર્તિપૂજાકર્તા દર્શિએ આ વિષયની લંગાણુ  
ચર્ચા કરી છે છતાં પણ તે ત્રણે શ્રીરકાને એક સરખી  
રીતે લાગુ પડે છે એટલે ત્રણે શ્રીરકા સાથે મળીને સંયુક્ત  
સેવા મંડળો અને સેવાસદ્ધનોની વ્યવસ્થા કરે તો સંયુક્ત  
જૈન સમાજ માટે સોનાનો સૂરજ ઉગ્યા જેવું થાય-તીર્થી  
સંબંધીના અંદર-અંદરના અગડા એકદમ અટકી જાય  
અને તેના ઉપરના આકભણુ પ્રસંગે મજબુત સંયુક્ત  
મોરચો ઉલ્લો કરી શકાય. “મારું મારા બાપનું અને તારા માં

મારો લાગ” જેવી હીન મનોદ્શાનો પ્રત્યેક વ્યક્તિએ ત્યાગ કરી ઉદ્ધાર લાવપૂર્વક ન્યાય માર્ગનો જ આશ્રય લેવો જોઈએ. સંચુક્ત ખળથી, સામુદ્દર્યીક સંગહનપૂર્વક કાર્ય કરવાનો જમાનો આવી છેં-ઉતીષ્ઠ-જાયત થા એવી હાકલ પૂર્વક નવયુગના ઘડીયાળા વાગી રહ્યા છે Now or never ના સૂત્રનું રહુસ્ય સમજુ, આળસ અને પ્રમાદ ખંખેરી નાંખી, ચા હોમ કરીને ચઢો-કૃતોહ છે આગેની ઉદ્ઘોષણાપૂર્વક શિસ્તપૂર્વકની આગેકુચનો પ્રારંભ વગર વિલંબે કરવો જોઈએ.

સૌને શાસન દેવ પ્રત્યેની શુદ્ધ ઝૂદ્ધ અને સહભાવ	પૂર્વકની પ્રાર્થના કે-સૌ લાઈએને-પ્રત્યેક
આંતીમ	વ્યક્તિને શાસનદેવ સન્મંતિ આપે અને
પ્રાર્થના	સમાજ પ્રત્યેની પોતાની કૃજો અને જવા-
	ણદારીની સાથી સમજણ સાથી સમાજ
	પ્રત્યેનું ઝણુ અદ્દા કરવા પુરતા લાવના, શક્તિ અને ખળ
	આપે એજ અભ્યર્થના.



# યાત્રાળુ ભાઈઓને વિજસ્તિ.



સમસ્ત દેશભરમાંથી આપણા પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્યની યાત્રાએ આવનાર સર્વ યાત્રિક ભાઈઓને સવિનિય વિહિતકરવાનું કે-તાજેતરમાં જ લોકમાન્ય સૌરાષ્ટ્ર સરકારનું એકમ થતાં, સમસ્ત શૈવેતાંમણર મૂર્તિપૂજાક જૈનસંધનું પ્રતિનિધિત્વ ધરાવતી શેડ આણુંદળ કલ્યાણજીની પેઢીને પાલીતાણા દરખારને દરવર્ષે રૂ. ૬૦૦૦૦ લરવા પડતા હતા તે સૌરાષ્ટ્ર સરકાર તરફથી માર્ક કરવામાં આવ્યાથી શ્રી સીજગિરિની યાત્રા કરવાનું ઘણું જ સરલ અને સુગમ થઇ પડ્યું છે. વળી ખુદ પાલીતાણામાં આપણી જૈન ધર્મશાળાઓની સંખ્યા સારા પ્રમાણમાં હોવાથી તેમજ લોજનશાળા વગેરેની સારી સગવડ હોવાથી આપણા યાત્રીક ભાઈઓ મોટી સંખ્યામાં યાત્રાનો લાલ પ્રતિવર્ષે લઈ રહ્યા છે તેઓ સૌ ભાઈઓને શ્રી ગોધા જૈનસંધ તરફથી આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે કે-કેઠ પાલીતાણા સુધીની ટ્રોનની સગવડ થતાં અને આ તરફની પંચતીર્થ યાત્રામાં ગોધાને પણ સ્થાન મળેલું હોવાથી ગોધાના પરમ શાસન પ્રકાશક શ્રી નવખંડા પાર્શ્વનાથજીની યાત્રાનો લાલ લેવા ચુકવું નહિં.

‘ગોધા-પાઠણુ ગામ ગંલીર’ થી શરૂ થતી કાંય  
 કૃતિમાં સુખસ્થાન પ્રાપ્ત કરેલ ગોધા શહેર સારી વસ્તી ધરા-  
 વતું, અથગણ્ય પ્રાચીન સમયના બંદરોમાંનું એક સુપ્રસિદ્ધ  
 બંદર હતું. આપણા સુપ્રસીદ્ધ ન્યાય વિશારદ ન્યાયાચાર્ય  
 શ્રીમહ યશોવિજયજી ઉપાધ્યાય મહારાજાએ સં. ૧૭૧૭ માં  
 ગોધામાં જ રહીને ‘સમુદ્ર-૦હાણુ સંવાદ’ નામા ધરોજ  
 રસીક, બોધપ્રદ, અર્થગંભીર અને પદ લાદીત્યથી સૌ  
 કોઈને આચ્ચર્ય સુંગ કરે તેવો રાસ ૧૭ ઢળમાં બનાવેલો  
 છે. આ ગોધા બંદર અમદાવાદ જીવાના ગોધા તાલુકાનું  
 સુખ્ય શહેર ગણ્ય છે. પ્રીટીશ રાજ્ય અમલમાં બંદર  
 તરીકે તેને બરાબર ભીતવવામાં નહિ આંયાથી તે દીવસે  
 દીવસે પડતી દશામાં આવતું જય છે. આમ છતાં પણ  
 તેની પ્રાચીન જહોજલાલીના કારણે તે સુખ્ય ત્રણ દેરાસરો  
 એ જૈન ઉપાશ્રીએ, અને એ જૈન ધર્મશાળાએ ધરાવે છે અને  
 અધ્યાપી પણ તે ગધા સુંયવસ્થિત સ્થિતિમાં જગવાઈ રહ્યા છે.

ઉપરોક્ત ત્રણ દેરાસરો પૈકી શ્રી નવખંડાપાર્થનાથનું  
 છે. તે ઘણું વિશાળ, રમણીય અને સર્વ રીતે આકર્ષક છે.  
 આ દેરાસરની વચ્ચે, શ્રી નવખંડાપાર્થનાથજીનું પરમ  
 આદહાદક અને વિશાળ રંગમંડપ સાથે લંબ મંદીર આવેલું  
 છે અને સુખ્ય દેરાસરની ચારે બાજુથી સુરક્ષિત કોઠાએ  
 સાથેના મજબૂત બાંધણીના ગઠની બંદરના વિશાળ કમ્પા-  
 ઉડમાં ચારખાનું ચાર દેરાસરો—શ્રી શાંતિનાથજી, શ્રી સુવિ-  
 ધિનાથજી, શ્રી ચૌમુખજી અને નેમિનાથજીના આવેલા છે.  
 ગામમાંના બીજા એ દેરાસરોમાં એક શ્રી ચંદ્રપ્રભુજીનું અને

છીણું શ્રી જીરાવળા પાર્વતિનાથજીનું છે. સાધુ સાધ્વીઓ માટેના એ વિશાળ ઉપાશ્રીયો છે. તેનું રીપેર્સિંગ કામ હાલમાં હાથ ધરવામાં આવેલ છે. અને ખાસ સાધ્વીજીઓ માટેના ઉપાશ્રીયની આગળની જગ્યાન મુખ્ય રાજ્યમાર્ગ ઉપરની મેળવી લેધ કેટલુંક તહીન નવીન બાંધકામ પાચામાંથી જ શરૂ કરવામાં આવેલ હોઢ તે એક લંબ્ય, વિશાળ અને અનેક રીતે ઉપયોગી થઈ પડે તેવું સુશોલીત મકાન તૈયાર થાય તેવી આશા રાખવામાં આવે છે.

લાવનગરથી ફૂક્ત ખાર માઇલને અંતરે આવેલ ગોધા સુધીની પાકી સડક હોવાથી, દીવસમાં ચાર વખત જતી-આવતી નીયમીત મોટર સર્વીસની અનુકૂળતા હોવાથી યાત્રાળું લાઇઓ તેનો ધણી સારી રીતે લાલ લઈ શકે છે. મોટરની ટીકીટના ફૂક્ત દસ આના રાખવામાં આવેલ છે. વળી યાત્રીક બંધુઓ સુખ સમાધિપૂર્વક-શાંતિથી સેવા-પૂજા-દર્શન અને યાત્રાનો સારી રીતે લાલ લેધ શકે તે ગણુતરીએ જરૂર પુરતી તમામ સગવડ ઉપરાંત શ્રી ગોધા જૈન સંધ તરફથી એક વખત ભાતાની સગવડ પુરી પાડતું તલાટી ખાતું છેલ્લા વીસેક વરસથી શરૂ કરવામાં આવેલ છે અને તે સુવ્યસ્થિત રીતે ચાલી રહેલ છે. નજીક નજીકમાં જ દેરાસર ઉપાશ્રી વગેરેની સર્વાંશે ધણી સારી અનુકૂળતા હોવાથી સાધુ-સાધ્વીઓનું ચોમાસું લાગ્યે જ ખાલી જય છે. ગોધાના હવા-પાણી પણ નિરોગી સુખાકારી અને આરોગ્ય વર્ધક ગણ્યાય છે. શ્રી ગોધા જૈનસંધનો વહીવટ શેડ કાળા મીઠાના નામથી કરવામાં આવે છે. સંધ-

હસ્તકના જુદા જુદા ખાતાએ પૈકી હેવ દ્રોય, શાન્દ્રોય,  
જીવદ્યા વગેરે ખાતામાં સારો વધારો છે; પરંતુ સાધારણુ  
ખાતામાં તેમજ પાંજરાપોળ ખાતામાં ધણો ટોટો છે. દ્યા-  
પાર રોજગાર તહેન પડી લાંગવાથી કેાઇ જતનો વ્યાપારી  
લાસો પાંજરાપોળ ખાતે નથી. વસ્તીનો મહેટો લાગ ધંધાર્થ  
પરદેશ ચાલ્યા જવાથી પાંજરાપોળ ખાતું જૈનભાઈએને જ  
સંભાળવાનું રહે છે અને તે ખાતે છેલ્લા કેટલાક વરસોથી  
જુજ આવકના પ્રમાણુમાં ખર્ચ ધણો નધારે થતો હોવાથી  
હેવદ્રોયનું ધણો મોટી રકમનું દહણું એંચાયે જય છે  
અને પ્રતિ વર્ષ તેમાં વધારો થતો જય છે એટલે સૌ  
લાઈએને આ બજો ખાતાએ તરફ પોતાનો ઉદાર હાથ  
લંખાવવા વિનંતિ છે.

ઉપરોક્ત પરિચિથિતિ આગળ કરી સો યાત્રાનું ભાઈએને  
ગોધાની યાત્રાનો લાલ લેવા કરી આથર્હપૂર્વક વિનંતિ  
કરીએ છીએ:—માહે અકટોબર સને ૧૯૪૮  
વકોલ ન્યાલચંદ લક્ષ્મીચંદ શેડ જીવણુભાઈ ગોરધન  
નાણાવટી માણેકચંદ કરમચંદ સંઘવી રાયચંદ લલ્લુભાઈ  
શ્રી ગોધા જૈન સંઘના ( મુખ્ય કાર્યવાહકો.)



# સ્વ. શાંતમૂર્તિ

## શ્રી જ્યંતવિજયજી મહારાજકૃત

૧. વિહારવર્ણન.	૦-૧૨-૦
૨. આબુ ભાગ ૧લો ત્રીજ આવૃત્તિ ટૂંક સમયમાં મહાર પડશે.	
૩. આબુ ભાગ ૨જો, અપ્રાપ્ય	૫-૦-૦
૪. જાબુ ભાગ ૩જો અચલગઢ, આવૃત્તિ બીજી	૧-૮-૦
૫. આબુ ભાગ ૪થો ( પ્રદક્ષિણા વર્ષાંન )	૨-૮-૦
૬. આબુ ભાગ ૫મો ( પ્રદક્ષિણા લેખસદ્દાહ )	૫-૦-૦
૭. શાંખેશ્વર મહાતીર્થ	૧-૬-૦
૮. ઉપરિયાદા તીર્થ	૦-૬-૦
૯. હમીરગઢ તીર્થ	૦-૬-૦
૧૦. સમેતશિખર તીર્થ	૦-૬-૦
૧૧. ચિત્રમય અચલગઢ ( આદ્યમ )	૦-૮-૦
૧૨. શાંખેશ્વર સ્તવનાવલિ	૦-૮-૦
૧૩. ચિત્રમય શાંખેશ્વર ( આદ્યમ )	૦-૬-૦

## મુનિરાજ વિશાળવિજયજીકૃત

૧. દ્વારાષટ્રિમાર્ગણાસંગ્રહ ( યંત્રયુક્ત )	૩-૦-૦
૨. સંસ્કૃત-પ્રાચીન-સ્તવન-સંદોહ આમા સંસ્કૃતનાં નાનાં પણ સુંદર ભાવપૂર્ણ ૩૭ પ્રાચીન સ્તવનોનો સંગ્રહ મુનિરાજશ્રીએ સંપાદિત કરેલ છે.	૦-૩-૦
૩. સુભાષિતપદ્યરલાકરઃભાગ-૨-૩-૪ દરેકના ડિ. ર. ૨-૦-૦	
પાકું ખાઈન્ડીગ	

જૈન આગમ, જૈન તત્ત્વજ્ઞાન, જૈન ન્યાય, જૈન  
 ન્યાકરણું, જૈન સાહિત્ય, જત વિધિવિધાન,  
 કિયાકંડ તથા પ્રકરણુંટિ વિષયોનાં  
 ગુજરાતી, હિન્દી સંસ્કૃત, પ્રાકૃત  
 તેમજ અંગ્રેજી લાખાનાં  
 પ્રા ચી ન-અ વર્ષ ચી ન  
 પુસ્તકો મેળવવાનું  
 ઉત્તમ સ્થાન



શ્રી યરોવિજયજી જૈન ગ્રંથ માળા  
 ગાંધીચાક, ભાવનગર (સૌરાષ્ટ્ર)

જૈન સાહિત્યના અંથો ઉપરાંત સામાન્ય  
 સાહિત્યના અંથો પણું માગણી સુજખ પૂરા  
 પાડવામાં આવે છે.

આત્મિક વ્યાધિની સુધારણા નિમિત્તે આપના  
ધર્મના સિદ્ધાન્ત શ્રેષ્ઠ છે એ વિષે જને કશીયે શંકા નથી  
જૈનધર્મના માર્ગદર્શનથી, એ ધર્મના અનુયાયી જે તે  
મનુષ્યનું ચારિત્ર જને છે એ નિઃસંદેષ છે.

પ્રો. હર્મન જેકોણી.